



93
જામનગર વાણિજ્ય બેંક લિમિટેડ

ધી જામનગર ડીરેક્ટ કો-ઓપ. બેંક લી., જામનગર



પ્રતાપસિંહ સીદ્ધલા જડેજા

ચેરમેન

ધી જામનગર ડી. કો-ઓપ. બેંક લી.

જામનગર.

બેંકનો વહીવટ પારદર્શક તેમજ નિષ્પક્ષ રીતે કરી બેંકની ઉત્તરોત્તર પ્રગતિ માટે હંમેશા કામ કરતો રહીશ.

મારા દ્વારા બેંકનો વહીવટ સંભાળ્યા બાદ કર્મચારીઓની હાજરી તેમજ નિયમિત કામગીરી બાબતે પુરતું ધ્યાન આપવામાં આવેલ છે. તેમજ વર્ષોથી જામજોધપુર/જામનગર (રૂરલ બ્રાંચ) ની ઈન્ટરનલ ઓડીટની કામગીરી પેન્ડીંગ હતી જે પુર્ણ કરાવી સત્ય હકીકત બહાર લાવી ઉચાપતમાં સામેલ કર્મચારીઓને સસ્પેન્ડ કરેલ છે તેમજ લગત વ્યક્તિઓ સામે સી.આઈ.ડી. કાર્દમ બ્રાંચમાં સત્ય હકીકત બહાર આવે તે માટે ફરીયાદ પાળ કરેલ છે.

સમયાંતરે નિયમિતપાળે એકઝી./બોર્ડ/પેટા સમિતિની મીટીંગો બોલાવેલ છે. તેમજ ખાસ કરીને બેંકના N.P.A. માં ઘટાડો કરવા માટે સઘન પ્રયાસો કરેલ અને સારી એવી વસુલાત પાળ કરેલ છે.

બેંક સાથે જોડાયેલ તમામ ખેડૂત સભાસદો, મંડળીઓ, બેંકનો વિકાસ થાય તેવી શુભેચ્છા પાઠવું છું અને બેંકની કર્મચારીની કામગીરીને આ તકે બીરદાવું છું.

પ્રતાપસિંહ સીદ્ધલા જડેજા

જય સહકાર

જય જવાન
ભારત માતા કી જય

જય કિશાન

૨૦૨૨

1

સને ૨૦૨૧-૨૦૨૨ ના વર્ષનો વાર્ષિક અહેવાલ

બેંકના માનનીય સભાસદ ભાઈઓ, બહેનો અને સહકારી સ્વજનો સૌને મારા નમસ્કાર સાથે જય સહકાર.

બેંકની આ અપિરત સફરના પુરા થતાં ૬૩ માં વર્ષની કામગીરીના વાર્ષિક હિસાબો - અહેવાલ આપની સમક્ષ ગર્વ સાથે રજુ કરતાં હર્ષની લાગણી અનુભવું છું. મારા પર તેમજ મારા સંચાલક મંડળ પર આપના દ્વારા જે વિશ્વાસ સાથે સુકાન સુપ્રત કરવામાં આવેલ છે, આ વિશ્વાસ પર ખરા ઉતરવા માટે અમે સંનિષ્ઠ પ્રયત્ન કરેલ છે. સફળતા અને શ્રેષ્ઠ પરિણામ આખરી નથી હોતા એ ધ્યાને લઈ અમે ઉત્કૃષ્ઠ પરિણામ આપવા માટે સેવક બની સેવા કરવા સતત પ્રયત્નશીલ રહીશું.

પિતેલ નાણાંકીય વર્ષની પિકટ પરિસ્થિતિમાં બેંકનો નફો જાળવી રાખીને તેમાં વધારો કરવામાં બેંકની નીચેની વ્યુહરચના સફળ થયેલ છે.

- (૧) બેંકની થાપણાઓ ઉપરના વ્યાજ દર અન્ય હરિફ બેંકો સાથે સ્પર્ધાત્મક અને નિયંત્રિત રાખીને વ્યાજના ખર્ચમાં ઘટાડો કરવો.
- (૨) બેંકની ટેકનિકલ સેવાનો વ્યાપ વધારીને તે અંગેની આવકમાં વધારો કરવો.
- (૩) કરકસરચુકત વહીવટ દ્વારા બેંકના વહીવટી ખર્ચમાં ઘટાડો કરવો.

ઉપરોક્ત વ્યુહરચનામાં બેંક સફળ રહેતા વર્ષના અંતે બેંકે રૂ. ૨૫,૬૨,૯૪૩.૦૨ ચોખ્ખો નફો કરેલ છે, જે ગત વર્ષની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધેલ છે.

બેંકના કાર્યક્ષેત્ર વિસ્તારની સેવા સહકારી મંડળીઓ મારફત ખેડૂતોને કિસાન કેડીટ કાર્ડ રૂપે પાક ધિરાણ પુરૂ પાડવામાં આવેલ છે. આવા ખેડૂતોને સરકારશ્રીના વ્યાજ વળતરનો લાભ પણ મળે છે. જેથી ખેડૂતોને ફાયદાકારક એવું કિસાન કેડીટ કાર્ડ સેવા સહકારી મંડળીના તમામ ખેડૂત સભાસદો સ્વીકારે તેવી કામગીરી કરવા સેવા સહકારી મંડળીના હોદ્દાઓ ને નમ્ર નિવેદન કહું છું. સેવા સહકારી મંડળીના સેક્રેટરી મિત્રો સેવા સહકારી મંડળીનું હિસાબી કામકાજ નિયમિત રીતે નિભાવે એ ખેડૂતોના વ્યાજ વળતરના લાભ માટે અતિ આવશ્યક બાબત છે. ખેડૂતોને વિવિધ આર્થિક લાભ આપી અપાવી ખેડૂત થકી મંડળીને આર્થિક સધ્ધરતા બક્ષવી એ મંડળીના હોદ્દાઓની પવિત્ર ફરજ છે.

સેવા સહકારી મંડળીની આર્થિક સધ્ધરતા વધારવા માટે નીચેના ઉપાયો સુચવું છું.

- (૧) જમીન ધારણ કરતા તમામ ખેડૂત સભાસદોને કિસાન કેડીટ કાર્ડ યોજના હેઠળ આવરી લેવા. જેટલું ધિરાણ વધારે એટલી નફાકારકતા વધારે.
- (૨) ખેડૂતોને કિસાન કેડીટ કાર્ડ હેઠળ ૭ ટકાના દરે પાક ધિરાણ પુરૂ પાડવામાં આવે છે. જે પૈકી નિયમિત વસુલાત ભરી દેનાર ખેડૂતને કેન્દ્ર સરકારશ્રી તરફથી ૩ ટકા વ્યાજ વળતર મળવાપાત્ર છે. બાકીનું ૪ ટકા વ્યાજ રાજ્ય સરકારશ્રી તરફથી નીતિ નિયમોને આધીન મળવાપાત્ર થાય છે. આમ ખેડૂતોને શૂન્ય વ્યાજદરે ધિરાણનો લાભ મળે છે. આ બાબત ખેડૂતને સમજાવી નિયમિત વસુલાત મેળવવી.
- (૩) સેવા સહકારી મંડળીનું હિસાબી કામકાજ નિયમિત રૂપે કરવું.

- (૪) સભાસદોને ધિરાણ ઉપરાંત અન્ય આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે ખાતર વેચાણ, અન્ય ગ્રુપન જરૂરી ચીજવસ્તુનું વેચાણ વગેરે પણ કરવું.
- (૫) મંડળીનો કરકસરયુક્ત વહિવટ નિભાવવો.
- આશા રાખું છું કે સેવા સહકારી મંડળીઓ અને મંડળીઓના હોદ્દેદારો ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઈને જે કાર્યપદ્ધતિ અપનાવશે અને તેમની સંસ્થાઓની નફાકારકતા વધારી ઉદાહરણરૂપ બનશે.
- બેંકની વિવિધ પ્રકારની કામગીરી અંગે નીચે મુજબ વિગતવાર બાબતો આપ સૌ સમક્ષ રજૂ કરું છું.

-: બેંકની કામગીરીનો અહેવાલ :-

૧. સભાસદ સંખ્યા :-

અહેવાલના વર્ષની શરૂઆતમાં બેંકની સભાસદ સંખ્યા ૭૫૬ હતી. વર્ષ દરમિયાન -- મંડળી સભાસદોની સંખ્યામાં વધારો થતા અને -- મંડળી સભાસદનો ઘટાડો થતા વર્ષાંતે સભ્ય સંખ્યા ૭૫૬ રહેવા પામેલ છે.

૨. બેંકના સ્વભંડોળો :-

(અ) શેર ભંડોળ :-

વર્ષની શરૂઆતમાં બેંકનું શેરભંડોળ અગાઉ રૂ. ૨૭૨૬.૯૯ લાખ હતું. વર્ષ દરમિયાન શેર ભંડોળમાં -- વધારો અને -- ઘટાડો થતાં વર્ષાંતે બેંકનું શેરભંડોળ રૂ. ૨૭૨૬.૯૯ લાખ થયાવત રહેવા પામેલ છે.

(બ) અન્ય ભંડોળો :-

અહેવાલના વર્ષની શરૂઆતમાં અન્ય ભંડોળો રૂ. ૧૩૭૪૮.૦૬ લાખ હતા તે વર્ષાંતે રૂ. ૧૪૯૧૧.૭૨ લાખ રહેલ છે જેમાં સ્ટેચ્યુટરી રીઝર્વ ફંડ ખાતે રૂ. ૮૦૫.૯૬ લાખ તથા ખરાબ અને શંકાસ્પદ લેણાં રીઝર્વ ખાતે રૂ. ૮૯૭૯.૭૦ લાખ, ફૂલત લેણાં અનામત ફંડ (કલમ ૬૭-ક મુજબ) રૂ. ૨૭૪.૧૨ લાખ, બેંક એન્ડ ડાઉટફુલ ડેબ્ટસ પ્રોવિઝન ફોર રૂલ એડવાન્સીઝ ખાતે રૂ. ૨૩૫૦.૦૦ લાખ, અન્ય ભંડોળો રૂ. ૨૪૭૬.૩૧ લાખ તથા વણ ફાળવાયેલ નફો રૂ. ૨૫.૬૩ લાખ સામેલ છે. જ્યારે રીઝર્વ ફોર ઓવરડ્યુ ઇન્ટેસ્ટ ખાતે રૂ. ૧૮૦૩.૩૪ લાખ છે.

૩. થાપણો :-

બેંકના વધતા જતા કામકાજ સાથે થાપણોમાં વૃદ્ધિ થવી આવશ્યક છે. બેંકના વિકાસ માટે થાપણો આધારશીલા સમાન છે. થાપણદારોના અતૂટ વિશ્વાસથી ગત વર્ષની બેંકની કુલ થાપણમાં રૂ. ૯૭૫૧.૩૩ લાખની વૃદ્ધિ સાથે તા. ૩૧-૩-૨૦૨૨ આખરે બેંકની કુલ થાપણો રૂ. ૭૮૪૨૧.૩૪ લાખ છે. તે પૈકી ચાલુ ખાતાની થાપણો રૂ. ૩૯૨૯.૪૫ લાખ, બચત ખાતાની થાપણો રૂ. ૪૩૨૩૨.૨૧ લાખ તથા બાંધી મુદત થાપણો રૂ. ૩૧૨૫૯.૬૮ લાખ છે, આમ, વર્ષાંતે બેંકની કુલ લો કોસ્ટ થાપણ ૬૦.૧૩% રહેવા પામે છે. બેંક દ્વારા વિવિધ પ્રકારની થાપણ

યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. બાંધી મુદતની થાપણ પર થાપણદારોને પ્રતિમાસ વ્યાજ મળી શકે તે માટે માસીક આવક યોજના હેઠળ બેંક દ્વારા થાપણો સ્વીકારવામાં આવે છે. આ યોજનામાં બાંધી મુદતની થાપણ મુકીને થાપણદાર દર મહિને વ્યાજની રકમ મેળવી શકે છે. થાપણ વૃદ્ધિ માટેના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે આપણાં સોના સહિયારા પ્રયાસો આવશ્યક છે.

૪. કર્જ :-

ધી ગુજરાત સ્ટેટ કો. ઓપ. બેંક લી. તથા નાબાર્ડના કર્જની વિગત નીચે મુજબ છે.

(અ) ટૂંકી મુદત ખેતિપિષયક :-

વર્ષ ૨૦૨૧ - ૨૦૨૨ માટે ધી ગુજરાત સ્ટેટ કો. ઓપ. બેંક લી. ની સ્વલંડોળની શાખ રૂ. ૨૦૦ કરોડ મંજૂર થયેલ છે. આ સ્વલંડોળની શાખમાંથી અહેવાલના વર્ષ દરમિયાન ઉપાડ કરેલ હતો. વર્ષાંતે આ ખાતામાં કોઈ રકમ બાકી રહેતી નથી. જ્યારે ગતવર્ષે મંજૂર થયેલ નાબાર્ડ શાખમાંથી કરેલ ઉપાડ પેકી રૂ. ૧૭૫૫૦.૦૦ લાખ બાકી રહે છે.

(બ) જુદી જુદી યોજના નીચે મેળવેલ મધ્યમ / લાંબી મુદતનું કર્જ :-

અહેવાલના વર્ષ દરમિયાન બેંકે, એપેક્ષ બેંક પાસેથી / દ્વારા નાબાર્ડ એ. આર. એસ. (એફ.એસ.) યોજના હેઠળ પુનઃધિરાણ મેળવેલ છે. આ રીફાઈનાન્સ (પુનઃધિરાણ) કર્જ ખાતામાં ફાર્મ મીકેનાઇઝેશન (ટ્રેક્ટર) કર્જ ખાતે રૂ. ૧૮૬.૫૦ લાખ તથા એ. આર. એસ. (એફ.એસ.) હેઠળ પ્રોજેક્ટ લેન્ડીંગ કર્જ ખાતે રૂ. ૨૮૮.૮૩ લાખ તથા નોન ફાર્મ સેક્ટર કર્જ ખાતે રૂ. ૦.૦૦ લાખ મળી, પુનઃધિરાણ કર્જ ખાતાઓમાં વર્ષાંતે કુલ રૂ. ૧૮૦૨૫.૩૩ લાખ બાકી છે. એપેક્ષ બેંકને વર્ષ દરમિયાન વખતોવખત જુદા જુદા કર્જ પેટે ચુકવવાની થતી રકમ બેંકએ ભરપાઈ કરી આપેલ છે.

૫. રોકાણો :-

રીઝર્વ બેંક / નાબાર્ડની માર્ગદર્શક સૂચનાઓ અને ગુજરાત રાજ્યના સહકારી કાયદાની કલમ-૭૧ અનુસાર બેંક દ્વારા રોકાણો કરવામાં આવે છે. વર્ષાંતે બેંકના એસ. એલ. આર. અનુસારના કુલ રોકાણો રૂ. ૧૪૮૬૮.૬૦ લાખ રહેલ છે. જે સંપૂર્ણપણે સરકારી જામીનગીરીમાં રોકવામાં આવેલ છે. અન્ય બેંકની બાંધી મુદત થાપણમાં રૂ. ૪૪.૦૦ લાખનું તથા ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લી. ની બાંધી મુદત થાપણમાં રૂ. ૧૧૨૦૦.૦૦ લાખનું રોકાણ કરવામાં આવેલ છે. જ્યારે અન્ય રોકાણોમાં સહકારી સંસ્થાઓના શેરમાં રૂ. ૧૪૬.૪૫ લાખ છે, ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર ક્લુ. ના શેરમાં રૂ. ૨.૧૨ લાખ છે. આમ, તા. ૩૧-૩-૨૦૨૨ આખરે વર્ષાંતે બેંકના કુલ રોકાણો રૂ. ૨૬૨૬૧.૧૭ લાખ છે. બેંકનું આ રોકાણ ૧૦૦% સ્ટાન્ડર્ડ છે. જે બેંકની નાણાકિય સદ્ધરતા દેખાડે છે.

૬. ધિરાણો :-

બેંકના ધિરાણોમાં ટૂંકી મુદત ખેતી પિષયક ધિરાણોનો હિસ્સો ઘણો મોટો રહેલો છે. અહેવાલના વર્ષાંતે કુલ ધિરાણોની રૂ. ૬૮૯૪૧.૯૯ લાખની બાકી સામે ટૂંકી મુદત ખે. પિ. અને મધ્યમ મુદત (કન્વર્ઝન) ધિરાણોની કુલ બાકી રૂ. ૬૪૧૩૦.૦૩ લાખ છે જે કુલ ધિરાણોના ૯૩ ટકા છે અને અન્ય ધિરાણોની બાકી ૭ ટકા રહે છે. જ્યારે સને ૨૦૨૦-૨૦૨૧ ના વર્ષાંતે કુલ ધિરાણો રૂ. ૭૧૦૪૨.૯૭ લાખ બાકી હતા જેમાં ટૂંકી મુદત ખેતિ પિષયક અને

મધ્યમ મુદત (કન્વર્ઝન) ધિરાણોનો હિસ્સો રૂ. ૬૫૩૯૬.૧૬ લાખ હતો જે કુલ ધિરાણના ૯૨ ટકા થતો હતો અને અન્ય ધિરાણોનો હિસ્સો ૮ ટકા રહેલો હતો.

ખેતિ પિધયક ધિરાણો :-

(૧) ટૂંકી મુદત ખેતિ પિધયક ધિરાણો :-

બેંકની સને ૨૦૨૧-૨૦૨૨ના વર્ષના અંતે ટૂંકી મુદત ખેતિ પિધયક ધિરાણની કુલ બાકી રૂ. ૬૪૪૨૬.૮૯ લાખ છે. બેંકની સને ૨૦૨૧-૨૨ના વર્ષના અંતે ટૂંકી મુદત બિન ખેતિ પિધયક ધિરાણની કુલ બાકી રૂ. ૧૩૫૨.૨૨ લાખ છે.

(૨) મધ્યમ મુદત ખેતિ પિધયક ધિરાણો :-

બેંકની સને ૨૦૨૧-૨૨ના વર્ષના અંતે મધ્યમ મુદત ખેતિ પિધયક ધિરાણની કુલ બાકી રૂ. ૪૬૭.૬૫ લાખ છે. બેંકની સને ૨૦૨૧-૨૨ના વર્ષના અંતે મધ્યમ મુદત બિન ખેતિ પિધયક ધિરાણની કુલ બાકી રૂ. ૫૯૩.૪૯ લાખ છે.

(૩) લાંબી મુદત ખેતિ પિધયક :-

બેંકની સને ૨૦૨૧-૨૨ના વર્ષના અંતે લાંબી મુદત ખેતિ પિધયક ધિરાણની કુલ બાકી રૂ. ૧૭૬૦.૧૬ લાખ છે. બેંકની સને ૨૦૨૧-૨૨ના વર્ષના અંતે લાંબી મુદત બિન ખેતિ પિધયક ધિરાણની કુલ બાકી રૂ. ૩૪૧.૫૮ લાખ છે.

૭. લેણાંની વસુલાત :-

બેંકના ધિરાણ પૈકી મોટો ભાગ મોસમી ધિરાણ છે. આ ધિરાણની વસુલાત મોસમની ઉપજમાંથી વસુલ લેવાની હોય છે અને આવા ધિરાણની વસુલાતનો સમય નવેમ્બર મહિનાથી જુન મહિના સુધીનો હોય છે. સામાન્ય રીતે ખેડૂતો પોતાની ખરીફ મોસમની ઉપજની રકમ જો વર્ષ સાફ હોય અને પિયતનું વાવેતર થઈ શકે તેમ હોય તો ખરીફ પાકની ઉપજ રપિ પાક મેળવવા ઉપયોગમાં લે છે. ઉપરાંતમાં ખેતિ આનુસાંગિક કામો અંગે પણ ખર્ચ કરતા હોય છે. ઉપરાંતમાં ઉત્પન્ન કરેલ માલના પોષણક્ષમ ભાવો લેવા માટે માલનું વેચાણ મોડેથી કરતા હોય છે જેથી સારા વર્ષે પણ મે મહિનાથી જ મોટાભાગની વસુલાત શરૂ થાય છે. આમ આ બાબત ખેત ઉત્પન્ન વેચાણ સાથે સંકળાયેલ છે. જુન-૨૦૨૧ સુધીમાં ટૂંકી મુદત ધિરાણોની ૮૦.૪૯ ટકા અને વસુલવાપાત્ર બધા ધિરાણોની ડીમાન્ડ સામે ૭૯.૫૨ ટકા વસુલાત આવેલ છે. આ ક્રમ અપિરતપણે ઉત્તરોત્તર વધારા સાથે વધતો રહે તે માટે આપણે સૌએ સહીયારા પ્રયત્નો કરવા જોઈએ કારણ કે એપેક્ષ બેંક અને જીલ્લા બેંક વચ્ચે પરસ્પર સમજુતીના જે કરારો કરવામાં આવે છે તેમાં વસુલાતની ઉચી ટકાવારીનો આગ્રહ રાખવામાં આવે છે. જો વસુલાતની ટકાવારી ખુબજ સંતોષકારક રહે તો સંસ્થાઓ ધિરાણ પ્રોત્સાહિત થાય તેટલું જ નહીં પરંતુ નફા માટે ગણતરીમાં લીધેલી જોગવાઈ અન્વયે થયેલી આવક તે પછીના સમયમાં સંસ્થાના પોતાના ભંડોળોમાં મૂડીરૂપે ઉદ્ભવે છે.

અહેવાલના વર્ષ દરમિયાન જુદા જુદા પ્રકારના લેણાંની ડીમાન્ડ રૂ. ૮૧૦૮૯.૭૯ લાખ સામે વસુલાત રૂ. ૬૪૪૭૯.૬૪ લાખ થયેલ છે, જે ૭૯.૫૨ ટકા વસુલાત છે.

૮. મૂડીના વર્ગીકરણનાં ધોરણો અનુસાર કરવામાં આવેલ જોગવાઈઓ :- (NPA)

ધિરાણના હેતુ માટે રોકાણ કરવામાં આવેલ મૂડી (અસ્કયામતો) કેટલે અંશે ઉપજાઉ છે અને ઉપજાઉ લેણાં આધારિત નફામાં લેવામાં આવતા વ્યાજ આવકની રકમની ચથાર્થતા છે કે કેમ તે માટે રીઝર્વ બેંક તરફથી જીલ્લા અને રાજ્ય સહકારી બેંકને અસ્કયામતોનું વર્ગીકરણ, આવક માન્યતા, પિ. બાબતો અંગેના ધોરણો સને ૧૯૯૬-૧૯૯૭ના વર્ષથી લાગુ પાડવામાં આવેલ છે. બેંકે પ્રતિવર્ષ રીઝર્વ બેંક / નાબાર્ડની માર્ગદર્શિક રૂપરેખા અનુસાર એન. પી. એ. સંબંધેની પુરતી રકમની જોગવાઈઓ કરેલ છે અહેવાલના વર્ષ ૨૦૨૧-૨૦૨૨ના અંતે આ એન.પી.એ. સંબંધેની વિગત દર્શાવતું પત્રક આગળ ઉપર દર્શાવેલ છે.

-: એન. પી. એ. ની વિગત દર્શાવતું પત્રક :-

(રકમ રૂ. લાખમાં)

અ. નં.	લેણાંની વિગત	તા. ૩૧-૩-૨૦૨૨ આખરે બીન ઉપજાઉ એન.પી.એ.	રીઝર્વ બેંકની ગાઈડ લાઈન અને એન.પી.એ. ધોરણ મુજબ તા. ૩૧-૩-૨૨ સુધીમાં કરવાના થતા પ્રોવિઝનની રકમ
૧	સ્ટાન્ડર્ડ એસેટ્સ (પડપડક.રર)	-	૧૪૨.૭૯
૨	સબ સ્ટાન્ડર્ડ	૬૬૬.૫૪	૬૬.૬૬
૩	શંકાસ્પદ લેણું	૨૧૧૮.૩૭	૧૫૦૧.૪૫
૪	નુકશાની અસ્કયામતો	૯૦૫૩.૫૫	૯૦૫૩.૫૫
	સરવાળો	૧૧૮૩૮.૪૬	૧૦૭૬૪.૪૫
૫	બીન ઉપજાઉ વ્યાજ	૮૦૮.૧૫	૮૦૮.૧૫
	કુલ સરવાળો	૧૨૬૪૬.૬૧	૧૧૫૭૨.૬૦
૧	એકંદરે કરવાના થતા પ્રોવિઝનની રકમ	૧૨૬૪૬.૬૧	૧૧૫૭૨.૬૦
૨	ગત વર્ષ સુધીમાં કરવામાં આવેલ પ્રોવિઝનની રકમ (સ્ટાન્ડર્ડ એસેટ સામેની જોગવાઈ રૂ. ૧૫૨.૬૭ લાખ સહિત) (બેંક એન્ડ ડાઉટફુલ પ્રોવિઝન ફોર રૂરલ એડ.)	-	૧૦૭૨૧.૩૧
૩	ચાલુ વર્ષ કરવાના થતા પ્રોવિઝનની રકમ	-	૨૩૫૦.૦૦
૪	ચાલુ વર્ષ કરવામાં આવેલ પ્રોવિઝનની રકમ	-	-
૫	એકંદરે કરવામાં આવેલ પ્રોવિઝનની રકમ	-	૨૧૪.૪૦
	સરવાળો	-	૧૩૨૮૫.૭૧
			૧૩૨૮૫.૭૧

૯. વાર્ષિક હિસાબો, વર્ષાન્તે નફા-નુકશાનની સ્થિતિ તથા નફાની વહેંચણી :-

રીઝર્વ બેંક/નાબાર્ડના પરીપત્ર અનુસાર આ બેંક સને ૧૯૯૬-૯૭ના વર્ષથી આવક માન્યતા, લેણાં વર્ગીકરણ અને તે સંબંધે બેંકના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કરવાની થતી જોગવાઈઓ માટે એન.પી.એ. ના ધોરણો લાગુ



ધી જામનગર ડીસ્ટ્રીક્ટ કો-ઓપ. બેંક લી., જામનગર

પાડવામાં આવેલ છે. આ અહેવાલના વર્ષ દરમિયાન બેંકનો કાર્યો નફો રૂ. ૧૬,૨૫,૧૭૪૨૬.૧૯ પૈસા થયેલ છે.

તા. ૩૧-૩-૨૦૨૨ ના રોજ પુરા થતાં નાણાંકીય વર્ષના વાર્ષિક હિસાબોમાં ખરાબ અને શંકાસ્પદ લેણાં રીઝર્વ ખાતે રૂ. ૨,૯૦,૦૦,૦૦૦.૦૦ ની જોગવાઈ કરવામાં આવેલ છે.

આ ઉપરોક્ત કાર્યા નફાની રકમમાંથી અહેવાલના વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન બીઝનેસ પ્રમોશન ખર્ચ અંગે પણ રૂ. ૨૨,૦૦,૦૦૦ ની રકમ ચુકવવા પાત્ર બને છે. જેનું પ્રોવીઝન કરવામાં આવેલ છે. વિશેષમાં ચુકવવા પાત્ર થતાં હકક રજાના રૂ. ૧,૧૨,૬૧,૧૩૬.૭૧ તથા ચુકવવા પાત્ર ઓડીટ ફી રૂ. ૫,૦૦,૦૦૦.૦૦ તથા બેંક એન્ડ ડાઉટફુલ ડેબટ્સ ફોર રૂરલ એડવાન્સીઝ ના રૂ. ૫૩૦૦૦૦૦૦.૦૦ તથા સ્ટાફ ફોડ રૂ. ૩૧૮૦૨૪૧૭.૦૦ તથા ઇન્ટરબ્રાંચ એડ રૂ. ૨૭૪૭૫૬૪૫.૧૯ તથા સન્ડ્રીડેટર્સ રૂ. ૩૫૧૪૨૮૪.૨૭ ચુકવવાપાત્ર ઇન્કમેટેક્સનાં રૂ. ૧૨,૦૦,૦૦૦/- નું પ્રોવિઝન કરેલ છે. આમ આ બધા સંદર્ભમાં ઉપરોક્ત કુલ ચુકવવા પાત્ર રકમ રૂ. ૧૫,૯૯,૫૩,૪૮૩.૧૭ ઉપર જણાવેલ કાર્યા નફાની રકમમાંથી બાદ જતાં વર્ષાન્તે ચોખ્ખો નફો રૂ. ૨૫,૬૨,૯૪૩.૦૨ રહેલ છે. જેની ફાળવણી બેંકના પેટા નિયમ/સહકારી કાયદાની જોગવાઈ મુજબ નીચે જણાવ્યા પ્રમાણે કરવામાં આવે તેવી ભલામણ બેંકના સંચાલક મંડળે વાર્ષિક સાધારણ સભાને કરેલ છે.

	રૂ.	પૈસા
સને ૨૦૨૧ - ૨૦૨૨ ના વર્ષનો ચોખ્ખો નફો	૨૫,૬૨,૯૪૩.૦૨	
૧. સ્ટેચ્યુટરી રીઝર્વ ફંડ ૨૫% મુજબ	૬૪૦૭૩૫.૭૫	
૨. એગ્રી. સ્ટેબીલાઇઝેશન ફંડ ૧૫% મુજબ	૩૮૪૪૧.૪૫	
૩. ફૂલત લેણાં અનામત ફંડ (કલમ ૬૭-ક) ૧૫% મુજબ	૩૮૪૪૧.૪૫	
૪. બિલ્ડીંગ ફંડ	૧૧૫૩૩૨૪.૩૭	

અગાઉના વર્ષોના સરવૈયામાં દર્શાવ્યા અનુસાર પુનઃવસન યોજના અન્વયે ઉદ્ભવેલ વ્યાજ ફરકની રકમ રૂ. ૨,૬૨,૮૬,૮૭૨.૮૫ પૈસા છે. અગાઉના વર્ષના વાર્ષિક હિસાબોમાં આ રકમની જોગવાઈ કરેલ છે.

ઉપર જણાવ્યા મુજબની બેંકની કામગીરી અંગેનો બોર્ડ ઓફ ડીરેક્ટર્સનો અહેવાલ તથા બેંકની સાંપત્તિક પરિસ્થિતિ દર્શાવતા તા. ૩૧-૩-૨૦૨૨ના રોજ પુરા થયેલ સને ૨૦૨૧-૨૦૨૨ ના વર્ષના પ્રમાણિત થયેલા હિસાબી પત્રકો, સરવૈયું તથા નફા-નુકશાનના હિસાબો તથા બીન ઉપજાઉ મૂડીનું વર્ગીકરણ તથા જોગવાઈ અંગેના હિસાબી પત્રકો, તથા ઓડીટરશ્રીનો અહેવાલ નોંધ લેવા રજુ કરેલ છે.

સને ૨૦૨૨-૨૦૨૩ ના વર્ષ માટે અન્વેષકની નિમણૂક કરવા અને તેમનું મહેનતાણું નક્કી કરવા કે તે અંગે યોગ્ય નિર્ણય લેવા બોર્ડ ઓફ ડીરેક્ટર્સને અધિકૃત કરવા પિનંતી છે.



૧૦. બેંકના ભાષિ વિકાસ અંગેનું આયોજન

બેંક દરેક વર્ષે આગામી વર્ષમાં કરવાપાત્ર કામગીરીનું આયોજન કરે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં કામગીરીના લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે. આવા લક્ષ્યાંકને બેંકની તમામ શાખામાં વિભાજિત કરીને બેંકમાં એકદરે લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવે છે. બેંકની તમામ શાખાની દર ત્રણ મારો રિવ્યુ મીટીંગ અને ક્વીલ્ડ ઓફીસરની કામગીરીના મૂલ્યાંકન માટે પણ રીવ્યુ મીટીંગનું આયોજન નિયમિત રીતે કરવામાં આવે છે.

ઉપરોક્ત પ્રકારના પ્રયત્નોને અંતે બેંકના વર્ષ ૨૦૨૧-૨૨ ના મુખ્ય લક્ષ્યાંકો તથા સિદ્ધિઓની વિગત નીચે મુજબ છે.

સને ૨૦૨૧ - ૨૦૨૨

(રૂ. લાખમાં)

સિદ્ધિ કરવાના ક્ષેત્રો	લક્ષ્યાંક રૂ.	સિદ્ધિ રૂ.	સિદ્ધિ ટકા
૧. શેર મૂડી	૨૯૫૦.૦૦	૨૭૨૬.૯૯	૯૨ %
૨. રીઝર્વ ફંડઝ અને અન્ય ભંડોળ	૧૭૬૫૪.૧૯	૧૬૮૬૭.૭૩	૯૬ %
૩. થાપણો	૭૦૯૬૮.૫૦	૭૮૪૨૧.૩૪	૧૧૦ %
૪. બાહ્ય કર્જ	૩૦૫૦૦.૦૦	૧૮૦૨૫.૩૩	૫૯ %
૫. નવું ધિરાણ	૭૭૪૬૮.૨૦	૬૮૯૪૧.૯૯	૮૯ %

૧૧. સેવા સહકારી મંડળીઓનું કોમ્પ્યુટરાઇઝેશન :

ધી જામનગર ડી. કો. ઓપ. બેંક લી. સાથે ઘણી બધી સહકારી મંડળી ઓ જોડાયેલ છે. જે મંડળીઓ સભાસદોને ખેતિપિષયક તથા અન્ય હેતુઓ માટે ધિરાણ કરે છે. ધી જામનગર ડી. કો. ઓપ. બેંક લી., નો ઉદ્દેશ તમામ મંડળીના તમામ સભાસદોને ફાયનાન્સીયલ ઇન્ફલ્યુઝન દ્વારા નાણાંકીય પ્રણાલીમાં સાંકળી લેવાનો છે. સહકારી મંડળીઓ સર્વે ગ્રામ્ય સ્તર સુધી સંકળાયેલ હોય, ફાયનાન્સીયલ ઇન્ફલ્યુઝનમાં તેમનો ફાળો મહત્વનો છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે પાયાની સહકારી મંડળીઓની કામગીરી પારદર્શક અને વિશ્વાસપાત્ર બને, આ માટે સહકારી મંડળીઓએ ટેકનોલોજીથી સજ્જ થવું તે જરૂરી છે. સહકારી મંડળી પોતાના હિસાબો કોમન એકાઉન્ટીંગ સીસ્ટમ પ્રમાણે તૈયાર થાય તે સુનિશ્ચિત કરવાનું જરૂરી છે. મંડળીના હિસાબો અને અન્ય વ્યવહારો કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા તૈયાર કરવામાં આવે તો મંડળીઓની નાણાંકીય અને વહીવટી સ્થિતિને સમયાંતરે સમીક્ષા થઈ શકે.

ઉપરોક્ત ઉદ્દેશની પુર્તી કરવા બેંક દ્વારા ૨૫૩ જેટલી સહકારી મંડળીઓ ને કોમ્પ્યુટરાઇઝ તથા આધુનિક ટેકનોલોજી સાથે જોડેલ છે.



સહકારી મંડળીઓના હિસાબોનું કોમ્પ્યુટરાઇઝેશન થતાં સેવા સહકારી મંડળીઓને નીચેના લાભ થશે.

- (૧) સેક્રેટરીઓ માટે હિસાબી કામકાજ સરળ થશે.
 - (૨) શાખપત્રક/મિલ્કત પત્રક યિગેરે કોમ્પ્યુટર પ્રોગ્રામમાં તૈયાર થઈ જશે.
 - (૩) અવાર-નવાર પુરી પાડવામાં આવતી માહિતી પ્રોગ્રામમાંથી જ ઉપલબ્ધ બનશે.
 - (૪) ધિરાણ મેળવતા તમામ ખાતેદારોની વ્યાજની ગણતરી પણ પ્રોગ્રામ દ્વારા જ થશે તેથી ભુલોને અવકાશ રહેશે નહીં.
 - (૫) ઓડીટ ઇન્સ્પેક્શનની કામગીરી ઝડપી અને સરળ બનશે.
- બેંક સાથે સંલગ્ન તમામ સહકારી મંડળીઓને અપીલ કરવામાં આવે છે કે તેમના હિસાબી ચોપડાનું કોમ્પ્યુટરાઇઝેશન વહેલી તકે પૂર્ણ કરાવે, જે માટે ચાર્જના આસી. ઇન્સ્પેક્શનન ઓફસરનો સંપર્ક કરે.

૧૨. વનટાઈમ સેટલમેન્ટ યોજના

જુના અને જામી ગયેલ લેણાની વસુલાત માટેની યોજનાને મંજૂરી મળતા બેંકે વનટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મુકેલ છે. આવા જુના એ જામી ગયેલ લેણાની બેંકના નિતિ નિયમોનુસારની પાકતી રકમ ચક્રવૃદ્ધિ વ્યાજની ગણાતી હોય છે જેથી આવી વસુલાત આપવી લોન લેનાર માટે કઠીન કામ બને છે.

આવા જુના અને જામી ગયેલા લેણા કે જે. તા. ૩૧-૦૩-૨૦૧૫ પહેલા મુદત વીતી/ઓવરડ્યુ થયેલ હોય તેવા ખાતેદારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. આ યોજના હેઠળ સાદા વ્યાજદરની વ્યાજની ગણતરી કરવામાં આવે છે. બેંક સાથે સંયોજિત સેવા સહકારી મંડળીઓના ખાતેદારો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. તેમજ સારી એવી વસુલાત પણ આપે છે.

૧૩. ટેકનોલોજીકલ અમલીકરણ - વેલ્યુ એડેડ સર્વિસીઝ :

આજના બદલાતા સમયમાં કોમ્પ્યુટરાઇઝેશન અને તેને આનુસંગિક ટેકનોલોજી બેંકીંગ વ્યવસાયમાં મુખ્ય આધાર બની રહેલ છે. બેંકોની સફળતા માટે આજે કોમ્પ્યુટરાઇઝેશનને મહત્તમ રીતે અપનાવવું જરૂરી છે. આ માટે સમય સાથે સતત અપગ્રેડેશન કરતા રહેવું જરૂરી છે. જેથી ગ્રાહકોને ઉત્તમ ઝડપી અને સુરક્ષિત સેવાઓ આપી શકાય, આમ આપણી બેંકમાં CBS માં CTS/RTGS/NEFT/NACH/ACH જેવી સેવાઓ આપવામાં આવે છે.

આ ઉપરાંત બેંક દ્વારા Rupay ATM Debit Card / Rupay KCC Card / SMS Alerts / LPG Direct Benefit Transfer (DBTL) જેવી સેવાઓ આપવામાં આવે છે અને નજીકના ભવિષ્યમાં બેંક દ્વારા IMPS, E-Commerce, Mobile Banking, Internet Banking જેવી સેવાઓ ચાલુ કરવામાં આવશે. આમ બેંક દ્વારા ઇલેક્ટ્રોનિકલ તથા કેશલેસ બેંકીંગ સેવાઓ જે અપાઈ રહી છે તેમાં સતત અપગ્રેડેશન સાથે નવા અભિગમ અને નવી પદ્ધતિઓ દાખલ કરવામાં આવે છે. અને આ આધુનિક સેવાઓ સાથે સુસંગત રહી શકે તે માટે બેંક સતત પ્રયત્નશીલ છે.

આમ બેંકની રાહબરી હેઠળ ઉપયોગી સોફ્ટવેરના અપડેશન તેમજ આધુનિક ટેકનોલોજીનો અમલ કરવામાં ખાસ આગ્રહ રાખવામાં આવે છે, જેથી એક જ સ્થળે આપણા ગ્રાહકોને મહત્તમ લાભ મળી શકે અને બીજી બેંકોની સમકક્ષ રહી બેંકીંગ કામગીરી કરી ઉત્તમ ડીજિટલાઇઝેશન સેવાઓ પુરી પાડી શકે.

ટેકનોલોજીને અપનાવતા બેંકીંગ કામગીરી સરળ અને ઝડપી બનેલ છે. બેંક અનેક ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી શકે છે.

૧૪. નાણાંકીય સાક્ષરતા કેન્દ્ર (ફાયનાન્સીઅલ લીટરેસી સેન્ટર)

“ગાંવ બઢે તો દેશ બઢે” એવા નાબાર્ડ ના સુત્ર મુજબ નાબાર્ડની ભુમિકા હંમેશા ગ્રામીણ અર્થતંત્રને તંદુરસ્તી બક્ષવા માટેના પૂર્ણ પ્રયાસોના ભાગરૂપે નાબાર્ડના સહયોગથી બેંક દ્વારા ૫ તાલુકાના સેન્ટરની શાખાઓમાં નાણાંકીય સાક્ષરતા કેન્દ્ર કાર્યરત છે. આવા સેન્ટર દ્વારા બેંકીંગ વિષેની સામાન્ય જાણકારી અંગે આમ પ્રજાને માહિતગાર કરવામાં આવે છે. ઉપરાંત બેંકની વિવિધ યોજનાઓ, સરકારશ્રીની યોજનાઓ વગેરેની જાણકારી આપવામાં આવે છે. ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન FLC ના ૪૦ કેમ્પ તથા નૂકડ નાટક/શેરી નાટકના ૨૦ પ્રોગ્રામો કરવામાં આવેલ છે.

ખૂબ ખૂબ આભાર નાબાર્ડના સહયોગ અને સહકાર બદલ.

૧૫. ઇન્સ્પેક્શન/ઓડીટ :

(અ) શાખા :

બેંકનું સ્ટેચ્યુટરી ઓડીટ દરેક વર્ષે નિયમિતરૂપે નાબાર્ડ માન્ય પેનલના ઓડીટર મારફતે કરાવવામાં આવે છે. બેંકની તમામ શાખા અને મુખ્ય ઓફિસના ઓડીટની કામગીરી પૂર્ણ થયેલ છે.

વધુમાં બેંકના અધિકારીઓ દ્વારા પણ ઇન્ટરનલ ઇન્સ્પેક્શન તમામ શાખાઓનું હાથ ધરવામાં આવેલ છે. જે નાણાંકીય વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે કરાવવામાં આવે છે. જે અંગેની પ્રગતિશીલ કામગીરી ચાલુ છે અને આ કામગીરી બેંક દ્વારા નિયમિત ધોરણે કરવામાં આવે છે.

(બ) સેવા સહકારી મંડળીઓનું ઇન્સ્પેક્શન :

ત્રિસ્તરીયે ધિરાણ માળખાં હેઠળ બેંક સાથે સંલગ્ન સેવા સહકારી મંડળીઓના હિસાબોનું ઇન્સ્પેક્શન બેંક દ્વારા હાથ ધરવામાં આવે છે. સેવા સહકારી મંડળીઓના હિસાબો નિયમિત રીતે તૈયાર થતાં ન હોય બેંક ઇન્સ્પેક્શનની કામગીરી સમયસર પૂર્ણ કરી શકાતી નથી. જેથી સહકારી મંડળીઓના હોદ્દાઓને મંડળીના હિસાબો નિયમિતરૂપે તૈયાર થાય તે અંગે કાળજી લેવા અપીલ કરવામાં આવે છે.

૧૬. આભાર દર્શન :-

આ બેંકના નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન બેંકને જરૂરી માર્ગદર્શન અને સહકાર આપવા બદલ સરકારશ્રીના સહકાર વિભાગ અને સહકારી કચેરીઓ, નાબાર્ડ તેમજ સ્ટેટ કો-ઓપરેટીવ બેંક તેમજ આ બેંકના ઓડીટરશ્રી એસ. સી. માખેયા એન્ડ એસોસીએટસ, રાજકોટ તેમજ બેંક સાથે સંકળાયેલ તમામ સંસ્થાઓ અને વ્યક્તિઓ જે સર્વે બેંકના સંચાલન અને નાણાંકીય વ્યવહારોમાં ઉપયોગી રહેલ છે અને જેમનો સાથ સહકાર મળેલ છે તેઓ સર્વેનો અમો આભાર માનીએ છીએ.

બેંકની પ્રગતિમાં સહભાગી એવા આપ સૌ સભાસદો, સાથી ડીરેક્ટરશ્રીઓ, ગ્રાહકો અને થાપણદારો જેઓએ અમારા વહીવટમાં વિશ્વાસ મુકી સાથ અને સહકાર આપેલ છે તે બદલ સર્વેનો આભાર.

બેંકના રોજ-બરોજના કામકાજ અને જવાબદારીઓને પહોંચી વળવામાં બેંકના સર્વે કર્મચારીગણો ઉત્સાહપૂર્વક કાર્ય કરેલ છે અને ફરજો બજાવેલ છે તે માટે સર્વેને ધન્યવાદ.



અંતમાં આપણે સહુ વિશ્વાસ અને સુમેળભર્યા વાતાવરણમાં આ બેંકની સહકારી પ્રવૃત્તિના વિકાસમાં ભાગીદાર બની ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રતિબદ્ધ થઈએ એવી સદ્ભાવના સાથે પિરમું છું.

જામનગર

બોર્ડ ઓફ ડીરેક્ટર્સ વતી,

તા. ૦૮/૦૬/૨૦૨૨

(પ્રતાપસિંહ સીદુભા જાડેજા)
ચેરમેનશ્રી





INDEPENDENT AUDITOR'S REPORT

To,
The Members,
The Jamnagar District Co-Operative Bank Limited,
Jamnagar.

-Report on the Financial Statements :

We have audited the accompanying financial statements of The Jamnagar District Co-Operative Bank Limited ('the Bank') as at 31 March 2022, which comprise the Balance Sheet as at 31st March 2022, and the Profit and Loss Account, and the Cash Flow Statement for the year then ended, and a summary of significant accounting policies and other explanatory information.

-Management's Responsibility for the Financial Statements :

Management is responsible for the preparation of these financial statements that give a true and fair view of the financial position, financial performance and cash flow of the Bank in accordance with the Banking Regulation Act 1949 (as applicable to co-operative societies), the circulars, notification, guidelines and direction issued by the Reserve Bank of India and the National Bank for Agricultural and Rural Development, the Registrar of Cooperative Societies, Gujarat, the Gujarat Co-operative Societies Act, 1961, and the Gujarat Co-operative Societies Rules, 1961, (as applicable) and generally accepted accounting principles in India so far as applicable to the Bank. This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding of the assets of the bank and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statement that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

-Auditor's Responsibility

Our responsibility is to express an opinion on these financial statements based on our audit. We conducted our audit in accordance with Standards on Auditing issued by the Institute of Chartered Accountants of India. Those Standards require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether the financial statements are free from material misstatements.

And audit involves performing procedures to obtain audit evidence about the amounts and disclosures in the financial statements. The procedures selected depend on the auditor's judgment, including the assessment of the risks of material misstatement of the financial statements, whether due to fraud or error. In making those risk assessments, the auditor considers internal control relevant to the Bank's preparation and fair presentation of the financial statements in order to design audit procedures that are appropriate in the circumstances, but not for the purpose of expressing an opinion on effectiveness of the Bank's Internal control. An audit also includes evaluating the appropriateness of accounting policies used the reasonableness of the accounting estimates made by management, as well as evaluating the overall presentation of the financial statements.



ધી જામનગર કીસ્ક્રીકટ કો-ઓપ. બેંક લી., જામનગર

We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion.

-Opinion

In our opinion and to the best of our information and according to the explanations given to us, excepts of the matter described in the basis for qualified opinion paragraph, the aforesaid financial statements together with the Notes thereon give the information required by the Banking Regulation Act, 1949 (as applicable to co- operative societies), the Gujarat Cooperative Societies Act, 1961, the Gujarat Cooperative Societies Rules, 1961 and the guidelines issued by the National Bank for Agricultural and Rural Development (as applicable) and guidelines issued by Reserve Bank of India and Registrar of Cooperative societies, Gujarat in the manner so enquired and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India:

- (a) In the case of the Balance Sheet, of state of affairs of the Bank as at 31st March, 2022
- (b) In the case of the Profit and Loss Account, of the profit/loss for the year ended on that date; and
- (c) In the case of the Cash Flow Statement, of the cash flows for the year ended on that date

-Report on Other legal & Regulatory Requirement

The Balance Sheet and the Profit and Loss Account have been drawn up in Forms "A" and "B" respectively of the Third Schedule to the Banking Regulation Act, 1949 and provisions of the Gujarat Co-operative Societies Act, 1960 and the Gujarat Co-operative Societies Rules 1961.

We report That :

- (a) We have obtained all the information and explanations, which to the best of our knowledge and belief were necessary for the purpose of our audit and have found to be satisfactory except stated otherwise.
- (b) The transactions of the Bank which have come to our notice are within the powers of the Bank.
- (c) The accounting standard adopted by the bank are consistent with those laid down by accounting principle generally accepted in India so far as applicable to banks except accounting standard 10 (Accounting for Fixed Assets) and As 22 (Accounting for tax on income)
- (d) We have reviewed various statements and returns provided by the bank which are satisfactory and adequate for the purpose of our audit.

For S C Makhecha and Associates

Chartered Accountants

Vipul Dattani

Partner

M. No. 115544

Firm Reg. No. 120184W

Date : 31st May, 2022

Place : Jamnagar

UDIN : 22115544AKIEXB9733

ફોર્મ - એ તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ સરવૈયું

વિગત	પરિશિષ્ટ	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
મૂડી અને જવાબદારીઓ :			
શેર ભંડોળ	૦૧	૨૭,૨૬,૯૯,૧૦૦	૨૭,૨૬,૯૯,૧૦૦
રીઝર્વ તથા અન્ય ફંડો	૦૨	૧,૪૯,૧૧,૧૭,૮૭૬	૧,૩૭,૪૮,૦૬,૫૧૬
થાપણો	૦૩	૭,૮૪,૨૧,૩૪,૩૨૬	૬,૮૬,૭૦,૦૦,૯૧૬
કરજ	૦૪	૧,૮૦,૨૫,૩૩,૨૪૦	૭૮,૬૯,૧૨,૭૦૦
અન્ય જવાબદારીઓ અને જોગવાઈઓ	૦૫	૬૭,૩૮,૭૬,૫૧૪	૬૬,૧૩,૬૭,૩૬૫
સરવાળો		૧૨,૦૮,૨૪,૧૫,૦૫૬	૯,૯૬,૨૭,૮૬,૫૯૭
મિલકતો :			
રોકડ તથા રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં પુરાંત	૦૬	૮૬,૭૬,૫૧,૩૫૨	૫૬,૭૨,૩૧,૩૩૧
બેંકોમાં પુરાંત તથા કોલ અને ટૂંકી મુદતની થાપણ	૦૭	૧,૫૬,૧૭,૩૦,૪૧૪	૨૫,૪૭,૯૪,૭૨૫
રોકાણો	૦૮	૧,૫૦,૧૭,૧૭,૫૮૧	૧,૪૦,૨૨,૬૯,૫૦૯
ધિરાણો	૦૯	૬,૮૯,૪૧,૯૯,૪૧૮	૭,૧૦,૪૨,૯૬,૬૪૮
સ્થાવર મિલકતો	૧૦	૧૧,૪૫,૨૭,૦૭૧	૧૨,૦૩,૮૯,૩૧૩
અન્ય મિલકતો	૧૧	૧,૧૪,૨૫,૮૯,૨૧૯	૫૧,૩૮,૦૫,૦૭૧
સરવાળો		૧૨,૦૮,૨૪,૧૫,૦૫૬	૯,૯૬,૨૭,૮૬,૫૯૭
આકસ્મિક જવાબદારીઓ	૧૨	૯૦,૩૨,૯૪૬	૭૦,૪૫,૯૩૮

એકાઉન્ટીંગ પોલીસીઝ અને નોટ્સ ઓફ એકાઉન્ટ્સ માટે સામેલ અલગ પરિશિષ્ટ તપાસવું.

જે તે તારીખના અમારા અલગ રિપોર્ટ મુજબ

એસ. સી. માખેયા એન્ડ એસોસીએટ્સ

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

(સહી)

Vipul Dattani

Partner

M. No. 115544

Firm Reg. No. 120184W

Date : 31st May, 2022

Place : Jamnagar

UDIN :

22115544AKIEXB9733

ધી જામનગર ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી.

(સહી)

પી. એસ. રોલા

જનરલ મેનેજર

(ઇન્ચાર્જ)

(સહી)

જે. વી. નંદાસણા

મેનેજર (એકાઉન્ટ્સ આર.)

(ઇન્ચાર્જ)

૧. (સહી) શ્રી પ્રતાપસિંહ સીદુલા જાડેજા
૨. (સહી) શ્રી રાજેશભાઈ ભીખાભાઈ વાટી
૩. (સહી) શ્રી લુણાભા પત્રામલભાઈ સુમણીયા
૪. (સહી) શ્રી મુળુભાઈ હરદાસભાઈ બેરા
૫. (સહી) શ્રી પ્રયિણસિંહ હેમંતભાઈ ઝાલા
૬. (સહી) શ્રી જીવણભાઈ કાડ્ડભાઈ કુંભરવડીયા

૭. (સહી) શ્રી હેમંતભાઈ હરદાસભાઈ ખવા
૮. (સહી) શ્રી મેરગભાઈ કાનાભાઈ ચાવડા
૯. (સહી) શ્રી બલદેવસિંહ પ્રયિણસિંહ જાડેજા
૧૦. (સહી) શ્રી ઘરમશીભાઈ રામજીભાઈ ચનીયારા
૧૧. (સહી) શ્રી હસમુખભાઈ મનસુખભાઈ મોલીયા
૧૨. (સહી) શ્રી જીગરભાઈ રમેશભાઈ કુંડલીયા



ધી જામનગર કો-ઓપ. બેંક લી., જામનગર

ફોર્મ - બી

તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ પુરાં થતાં વર્ષનું નફા - નુકશાન પત્રક

વિગત	પરિશિષ્ટ	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
અ. આવક મળેલ વ્યાજ અન્ય આવક	૧૩ ૧૪	૮૦,૪૮,૯૭,૬૩૦ ૨,૫૩,૭૪,૦૯૬	૮૨,૮૩,૦૮,૩૧૯ ૨,૧૧,૯૦,૬૧૬
સરવાળો (અ)		૮૩,૦૧,૭૧,૭૨૬	૮૪,૯૪,૯૮,૯૩૫
બ. ખર્ચાઓ ચૂકવેલ વ્યાજ કાર્યકારી ખર્ચાઓ પ્રોવિઝન અને કન્ટ્રીન્જન્સીઝ	૧૫ ૧૬	૪૩,૬૨,૬૩,૭૦૯ ૨૩,૧૩,૯૧,૫૯૧ ૧૫,૯૯,૫૩,૪૮૩	૪૫,૮૮,૦૮,૮૮૭ ૨૨,૯૩,૫૯,૯૪૯ ૧૫,૮૯,૮૩,૫૯૦
સરવાળો (બ)		૮૨,૭૬,૦૮,૭૮૩	૮૪,૭૧,૫૨,૪૨૫
ક. વર્ષાન્તે ચોખ્ખો નફો (ખોટ) ગત વર્ષનો ચોખ્ખો નફો આગળ લાવ્યા		૨૫,૬૨,૯૪૩ ૪૧,૧૭,૫૯૬	૨૩,૪૬,૫૧૦ ૧૭,૭૧,૦૮૬
સરવાળો (ક)		૬૬,૮૦,૫૩૯	૪૧,૧૭,૫૯૬
૪. ચોખ્ખા નફાની કાળવણી રેટેન્યુટરી રીઝર્વ ફંડ ખાતે અન્ય ફંડો ખાતે એક્ટીવિટીઝ ક્રેડીટ રેટેલીનાઈઝેશન ફંડ ખાતે ફૂલત લેઉઆ અનામત ફંડ ખાતે (કલમ-૬૭૬) ખાતે મકાન ફંડ ખાતે સૂચિત કિયિડન્ડ (શેર મૂડીના (૧૫%))	૨૫% ૧૫% ૧૫% ૪૫%	૧૦,૨૯,૩૯૯ ૬,૧૭,૬૩૯ ૬,૧૭,૬૩૯ ૧૮,૫૨,૯૧૮	- - - -
સરવાળો		૪૧,૧૭,૫૯૬	
નફાનું બેલેન્સ સરવૈયામાં ખેંચતા		૨૫,૬૨,૯૪૩	૪૧,૧૭,૫૯૬

એકાઉન્ટીંગ પોલીસીઝ અને નોટ્સ ઓફ એકાઉન્ટ્સ માટે સામેલ અલગ પરિશિષ્ટ તપાસવું.

જે તે તારીખના અમારા અલગ રિપોર્ટ મુજબ

એસ. ટી. માખેયા એન્ડ એસોસીએટ્સ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

(સહી)

Vipul Dattani
Partner
M. No. 115544
Firm Reg. No. 120184W
Date : 31st May, 2022
Place : Jamnag
UDIN :- UDIN : 22115544AKJEXB9733

૧. (સહી) શ્રી પ્રતાપસિંહ સાવુલા જાડજી
૨. (સહી) શ્રી રાજેશ ભીખાભાઈ પાટી
૩. (સહી) શ્રી સુણાલા ખજાનજીભાઈ સુભાણીયા
૪. (સહી) શ્રી મુખુભાઈ હરદાસભાઈ બેરા
૫. (સહી) શ્રી પ્રવિણસિંહ હેમંતભાઈ ઝાલા
૬. (સહી) શ્રી જીવણભાઈ કાફળાઈ કુંભરપટ્ટીયા

ધી જામનગર કો-ઓપરેટીવ બેંક લી.

(સહી)

પી. એસ. રોલા

જનરલ મેનેજર

(ધવ્યાર્જ)

(સહી)

જે. વી. નંદાસણા

મેનેજર (એકાઉન્ટ્સ આર.)

(ધવ્યાર્જ)

૭. (સહી) શ્રી હેમંતભાઈ હરદાસભાઈ ખવા
૮. (સહી) શ્રી મેરગભાઈ કાલાભાઈ ચાવડા
૯. (સહી) શ્રી બલદેવસિંહ પ્રવિણસિંહ જાડેજી
૧૦. (સહી) શ્રી ધરમજીભાઈ રામજીભાઈ ચનીયા
૧૧. (સહી) શ્રી હસમુખભાઈ મનસુખભાઈ મોલીયા
૧૨. (સહી) શ્રી જીગરભાઈ સોવાભાઈ કુંડલીયા

૨૦૨૨

15

તા. ૩૧-૦૩-૨૦૨૨ના રોજ સરવૈયા અંગેના પરિશિષ્ટો

પરિશિષ્ટ - ૧

શેર ભંડોળ

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
(અ)	અધિકૃત શેર ભંડોળ		
૧.	૨૦,૦૦૦ શેરો દરેક રૂ. ૧,૦૦૦/- ના રાજ્ય સરકારશ્રી અને/અથવા સ્ટેટ કો-ઓપરેટીવ બેંકને આપવા માટે	૨,૦૦,૦૦,૦૦૦	૨,૦૦,૦૦,૦૦૦
૨.	૫૪,૫૨,૦૦૦ શેરો દરેક રૂ. ૫૦/- ના સહકારી મંડળીઓના કાયદા હેઠળ નોંધાયેલ સહકારી મંડળીઓને આપવા માટે	૨૭,૨૬,૦૦,૦૦૦	૨૭,૨૬,૦૦,૦૦૦
૩.	૨,૦૦૦ શેરો દરેક રૂ. ૫૦/- ના સહકારી સંસ્થા સિવાયના સભ્યોને આપવા માટે	૧,૦૦,૦૦૦	૧,૦૦,૦૦૦
	કુલ અધિકૃત શેર ભંડોળ	૨૮,૨૭,૦૦,૦૦૦	૨૮,૨૭,૦૦,૦૦૦
(બ)	બહાર પાડેલ અને ભરપાઈ થયેલ શેર ભંડોળ		
૧.	રાજ્ય સરકારશ્રીને આપેલ શેર		
૨.	સહકારી મંડળીઓને આપેલ શેર ૫૪,૫૨,૦૦૦ શેરો દરેક રૂ. ૫૦/- ના સહકારી મંડળીઓના કાયદા હેઠળ નોંધાયેલ સહકારી મંડળીઓને આપેલ.	૨૭,૨૬,૦૦,૦૦૦	૨૭,૨૬,૦૦,૦૦૦
૩.	૧૯૮૨ શેરો દરેક રૂ. ૫૦/-ના સહકારી સંસ્થા સિવાયના સભ્યોને આપેલ.	૯૯,૧૦૦	૯૯,૧૦૦
	કુલ શેર ભંડોળ	૨૭,૨૬,૯૯,૧૦૦	૨૭,૨૬,૯૯,૧૦૦

પરિશિષ્ટ - ૨

અનામત અને વધારો

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
(અ)	રીઝર્વ ફંડ		
૧.	સ્ટેચ્યુટરી રીઝર્વ ફંડ		
	શરૂઆતની બાકી	૮,૦૫,૯૬,૧૬૯	૭,૯૫,૬૬,૭૭૦
	(+) વર્ષ દરમિયાન વધારો	૭,૯૫,૬૬,૭૭૦	૭,૯૫,૬૬,૭૭૦
	(-) વર્ષ દરમિયાન ઘટાડો	૧૦,૨૯,૩૯૯	-
		-	-
૨.	એગ્રીકલ્ચરલ ક્રેડિટ સ્ટેબીલાઇઝેશન ફંડ		
	શરૂઆતની બાકી	૨,૯૮,૭૦,૫૩૫	૨,૯૨,૫૨,૮૯૫
	(+) વર્ષ દરમિયાન વધારો	૨,૯૨,૫૨,૮૯૫	૨,૯૨,૫૨,૮૯૫
	(-) વર્ષ દરમિયાન ઘટાડો	૬,૧૭,૬૩૯	-
		-	-



ધી જામનગર ડીસ્ટ્રીક્ટ કો-ઓપ. બેંક લી., જામનગર

તા. ૩૧-૦૩-૨૦૨૨ના રોજ સરવૈયા અંગેના પરિશિષ્ટો

પરિશિષ્ટ - ૨
અનામત અને વધારો

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
૩.	મકાન ફંડ શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૬,૬૮,૦૯,૫૨૩ ૬,૪૯,૫૬,૬૦૫ ૧૮,૫૨,૯૧૮ -	૬,૪૯,૫૬,૬૦૫ ૬,૪૯,૫૬,૬૦૫ - -
૪.	ડિપોઝિટ ઇક્વીલાઇઝેશન ફંડ શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૩,૦૮,૦૦૦ ૩,૦૮,૦૦૦ - -	૩,૦૮,૦૦૦ ૩,૦૮,૦૦૦ - -
૫.	ખરાબ અને શંકાસ્પદ લેણા રીઝર્વ ફંડ શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૮૯,૭૯,૭૦,૦૮૪ ૮૬,૮૯,૭૦,૦૮૪ ૨,૯૦,૦૦,૦૦૦ -	૮૬,૮૯,૭૦,૦૮૪ ૭૬,૩૯,૭૦,૦૮૪ ૧૦,૫૦,૦૦,૦૦૦ -
૬.	ફુલત લેણાં અનામત ફંડ (કલમ-૬૭ (ક) મુજબ) શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૨,૭૪,૧૧,૫૧૫ ૨,૬૭,૯૩,૮૭૬ ૬,૧૭,૬૩૯ -	૨,૬૭,૯૩,૮૭૬ ૨,૬૭,૯૩,૮૭૬ - -
૭.	ઇન્વેસ્ટમેન્ટ ડેપ્રીશિયેશન રીઝર્વ શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૧,૦૩,૧૬૬ ૧,૦૩,૧૬૬ - -	૧,૦૩,૧૬૬ ૧,૦૩,૧૬૬ - -
કુલ શેર ભંડોળ		૧,૧૦,૩૦,૬૮,૯૯૨	૧,૦૬,૯૯,૫૧,૩૯૬

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
(બ)	અન્ય રીઝર્વ ફંડ		
૧.	સ્ટેટ લેવલ પ્રોજેક્ટ ફંડ શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૧,૩૧,૧૮૦ ૧,૩૧,૧૮૦ - -	૧,૩૧,૧૮૦ ૧,૩૧,૧૮૦ - -
૨.	સ્ટાફ ગ્રેયુઇટી ફંડ શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૫,૩૫,૬૪૫ ૫,૩૫,૬૪૫ - -	૫,૩૫,૬૪૫ ૫,૩૫,૬૪૫ - -

તા. ૩૧-૦૩-૨૦૨૨ના રોજ સરવૈયા અંગેના પરિશિષ્ટો

પરિશિષ્ટ - ૨

અનામત અને વધારો

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
૩.	સ્ટાફ બેનીફીટ ફંડ શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૯૩ ૯૩ - -	૯૩ ૯૩ - -
૪.	સહકારી પ્રચાર ફંડ શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૭,૦૪૧ ૭,૦૪૧ - -	૭,૦૪૧ ૭,૦૪૧ - -
૫.	પબ્લીક ચેરીટી ફંડ શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૪૧૪ ૪૧૪ - -	૪૧૪ ૪૧૪ - -
૬.	ખેતી વિકાસ ફંડ શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૪૬,૬૩,૯૫૦ ૪૬,૬૩,૯૫૦ - -	૪૬,૬૩,૯૫૦ ૪૬,૬૩,૯૫૦ - -
૭.	કન્ટીજન્સી રીઝર્વ શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૫,૩૩,૮૭૩ ૫,૩૩,૮૭૩ - -	૫,૩૩,૮૭૩ ૫,૩૩,૮૭૩ - -
૮.	બેંક એન્ડ કાઉન્ટર ડેબ્ટ પ્રોવિ.ફોર ડ્રલ એડવાન્સ શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૨૩,૫૦,૦૦,૦૦૦ ૧૮,૨૦,૦૦,૦૦૦ ૫,૩૦,૦૦,૦૦૦ -	૧૮,૨૦,૦૦,૦૦૦ ૧૮,૨૦,૦૦,૦૦૦ - -
૯.	સ્ટાફ ફોડ પ્રોવિઝન ફંડ શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૪,૫૬,૦૩,૦૩૨ ૧,૩૮,૦૦,૬૧૫ ૩,૧૮,૦૨,૪૧૭ -	૧,૩૮,૦૦,૬૧૫ ૧,૩૮,૦૦,૬૧૫ - -
૧૦.	ઇન્વેસ્ટમેન્ટ ફલકચ્યુએશન રીઝર્વ શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૬૩,૪૦,૩૨૭ ૬૩,૪૦,૩૨૭ - -	૬૩,૪૦,૩૨૭ ૧૬,૪૪,૨૫૬ ૪૬,૯૬,૦૭૧ -
૧૧.	રિવેલ્યુએશન રીઝર્વ શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો	૯,૨૭,૨૪,૩૮૬ ૯,૨૭,૨૪,૩૮૬ - -	૯,૨૭,૨૪,૩૮૬ - ૯,૨૭,૨૪,૩૮૬ -
૧૨.	નફા-નુકશાન ખાતાની બાકી	૨૫,૬૨,૯૪૩	૪૧,૧૭,૫૯૬
	સરવાળો (બ)	૩૮,૮૧,૦૨,૮૮૫	૩૦,૪૮,૫૫,૧૨૦
	એકંદર સરવાળો (અ+બ)	૧,૪૯,૧૧,૭૧,૮૭૬	૧,૩૭,૪૮,૦૬,૫૧૬

તા. ૩૧-૦૩-૨૦૨૨ના રોજ સરવૈયા અંગેના પરિશિષ્ટો

પરિશિષ્ટ - ૩

થાપણો

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
(અ)	ચાલુ થાપણો		
૧.	બેંકોની	-	-
	મધ્યસ્થ સહકારી બેંકો	-	-
	અન્યની		
૧.	વ્યક્તિઓ	૨૧,૭૬,૦૪,૭૩૯	૧૬,૮૧,૨૫,૭૬૮
૨.	અન્ય મંડળીઓ	૧૭,૫૩,૩૯,૯૫૨	૧૫,૨૩,૬૮,૫૩૧
		૩૯,૨૯,૪૪,૬૯૨	૩૨,૦૪,૯૪,૨૯૯
	કુલ (અ)	૩૯,૨૯,૪૪,૬૯૨	૩૨,૦૪,૯૪,૨૯૯
(બ)	બચત થાપણો		
૧.	વ્યક્તિઓ	૪,૩૦,૬૭,૮૧,૩૧૧	૩,૬૩,૦૦,૭૨,૭૯૬
૨.	અન્ય મંડળીઓ	૧,૬૪,૪૦,૦૭૪	૧,૪૬,૦૨,૨૦૫
	કુલ (બ)	૪,૩૨,૩૨,૨૧,૩૮૫	૩,૬૪,૪૬,૭૫,૦૦૧
(ક)	બાંધી મુદત થાપણો		
	બેંકોની		
૧.	મધ્યસ્થ સહકારી બેંકો	NIL	NIL
	અન્યની		
૧.	વ્યક્તિઓ	૨,૨૫,૮૪,૭૬,૮૩૮	૨,૩૨,૨૧,૯૧,૫૩૩
૨.	અન્ય મંડળીઓ	૮૬,૭૪,૯૧,૪૧૦	૫૭,૯૬,૪૦,૦૮૨
	કુલ (ક)	૩,૧૨,૫૯,૬૮,૨૪૮	૨,૯૦,૧૮,૩૧,૬૧૬
	એકંદર સરવાળો (અ + બ + ક)	૭,૮૪,૨૧,૩૪,૩૨૬	૬,૮૬,૭૦,૦૦,૯૧૬

પરિશિષ્ટ - ૪

કરજ

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
(અ)	ભારતમાં કરજ		
૧.	રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને એપેક્સ બેંકો	૧,૮૦,૨૫,૩૩,૨૪૦	૭૮,૬૯,૧૨,૭૦૦
૨.	અન્ય બેંકો	-	-
૩.	અન્ય સંસ્થાઓ અને એજન્સીઓ	-	-
(બ)	ભારત બહાર કરજ	-	-
	સરવાળો (અ + બ)	૧,૮૦,૨૫,૩૩,૨૪૦	૭૮,૬૯,૧૨,૭૦૦



ધી જામનગર ડીસ્ટ્રીક્ટ કો-ઓપ. બેંક લી., જામનગર

તા. ૩૧-૦૩-૨૦૨૨ના રોજ સરવૈયા અંગેના પરિશિષ્ટો

પરિશિષ્ટ - ૫ અન્ય જવાબદારીઓ અને જોગવાઈઓ

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
૧.	બીલ્સ પેમેન્ટ	-	-
૨.	ઇન્ટર બ્રાંચ એડજસ્ટમેન્ટ (નેટ)	-	-
૩.	ચૂકવવાપાત્ર વ્યાજ	૧૭,૬૭,૯૨,૪૯૪	૧૯,૬૧,૨૯,૬૨૦
૪.	અન્ય (જોગવાઈઓ સહિત)	૪૯,૭૦,૮૪,૦૨૦	૪૬,૫૨,૩૭,૭૪૫
	સરવાળો (અ + બ)	૬૭,૩૮,૭૬,૫૧૪	૬૬,૧૩,૬૭,૩૬૫

પરિશિષ્ટ - ૬ રોકડ તથા રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં પુરાંત

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
(અ)	ઢાઘ પર સિલક	૮૬,૭૬,૫૧,૩૫૨	૫૬,૭૨,૩૧,૩૩૧
(બ)	રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં પુરાંત		
૧.	ચાલુ ખાતામાં	-	-
૨.	અન્ય ખાતામાં	-	-
	સરવાળો (અ + બ)	૮૬,૭૬,૫૧,૩૫૨	૫૬,૭૨,૩૧,૩૩૧

તા. ૩૧-૦૩-૨૦૨૨ના રોજ સરવૈયા અંગેના પરિશિષ્ટો

પરિશિષ્ટ - ૭

બેંકોમાં પુરાંત તથા કોલ અને ટૂંકી મુદતની થાપણો

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
(અ)	ભારતમાં		
૧.	બેંકોમાં પુરાંત		
	(૧) ચાલુ ખાતાઓમાં	૪૩,૭૩,૨૯,૭૩૩	૨૫,૦૩,૯૪,૦૪૪
	(૨) અન્ય થાપણ ખાતાઓમાં	૧,૧૨,૪૪,૦૦,૦૦૦	૪૪,૦૦,૦૦૦
	કોલ અને ટૂંકી મુદતની થાપણો		
૨.	(૧) બેંકોમાં	-	-
	(૨) અન્ય સંસ્થાઓમાં	૬૮૨	૬૮૨
	સરવાળો (અ)	૧,૫૬,૧૭,૩૦,૪૧૪	૨૫,૪૭,૯૪,૭૨૫
(બ)	ભારત બહાર		
૧.	ચાલુ ખાતાઓમાં	-	-
૨.	અન્ય થાપણ ખાતાઓમાં	-	-
૩.	અન્ય સંસ્થાઓમાં	-	-
	સરવાળો (બ)	-	-
	એકંદર સરવાળો (અ + બ)	૧,૫૬,૧૭,૩૦,૪૧૪	૨૫,૪૭,૯૪,૭૨૫

પરિશિષ્ટ - ૮

રોકાણો

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
(અ)	ભારતમાં રોકાણો		
૧.	સરકારી જામીનગીરીઓ	૧,૪૮,૬૮,૬૦,૪૪૧	૧,૩૮,૭૪,૧૨,૩૬૯
૨.	અન્ય માન્ય જામીનગીરીઓ	-	-
૩.	શેરો	૧,૪૮,૫૭,૧૪૦	૧,૪૮,૫૭,૧૪૦
૪.	ફિબેન્ચર્સ અને બોન્ડ્સ	-	-
૫.	ગોણ અને / અથવા સંયુક્ત સાહસો	-	-
૬.	અન્ય (મ્યુચ્યુઅલ ફંડો)	-	-
	સરવાળો (અ)	૧,૫૦,૧૭,૧૭,૫૮૧	૧,૪૦,૨૨,૬૯,૫૦૯
(બ)	ભારત બહાર રોકાણો		
૧.	સરકારી જામીનગીરીઓ	-	-
૨.	ગોણ અને / અથવા સંયુક્ત સાહસો	-	-
૩.	અન્ય રોકાણો	-	-
	સરવાળો (બ)	-	-
	એકંદર સરવાળો (અ + બ)	૧,૫૦,૧૭,૧૭,૫૮૧	૧,૪૦,૨૨,૬૯,૫૦૯



ધી જામનગર ડીસ્ટ્રીક્ટ કો-ઓપ. બેંક લી., જામનગર

તા. ૩૧-૦૩-૨૦૨૨ના રોજ સરવૈયા અંગેના પરિશિષ્ટો

પરિશિષ્ટ - ૯ ધિરાણો

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂા. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂા. પૈસા
(અ)	૧. ખરીદેલા અને વટાવેલા બીલો ૨. રોકડ શાખા, ઓવરડ્રાફ્ટ અને લોન રીપેચેબલ ઓન ડીમાન્ડ. ૩. મુદતીય લોન	- ૬,૫૭,૭૯,૧૧,૦૨૧ ૩૧,૬૨,૮૮,૩૯૮	- ૬,૭૩,૬૨,૪૧,૫૦૦ ૩૬,૮૦,૫૫,૧૪૮
	સરવાળો (અ)	૬,૮૯,૪૧,૯૯,૪૧૮	૭,૧૦,૪૨,૯૬,૬૪૮
(બ)	૧. વાસ્તવિક મિલકતોથી સીકયોર્ડ ૨. બેંક / સરકારશ્રીની ગેરંટીથી રક્ષીત ૩. અનસીકયોર્ડ	૬,૮૯,૪૧,૯૯,૪૧૮ - -	૭,૧૦,૪૨,૯૬,૬૪૮ - -
	સરવાળો (બ) નોંધ : પ્રાથમિક ખેતિપિધાયક ક્રેડિટ મંડળીઓ મારફત આપેલ ધિરાણ નાબાર્ડના સ્પષ્ટીકરણ મુજબ સીકયોર્ડ ગણે છે.	૬,૮૯,૪૧,૯૯,૪૧૮	૭,૧૦,૪૨,૯૬,૬૪૮
(ક)	૧. ભારતમાં ધિરાણો (૧) પ્રાયોરીટી સેક્ટર (૨) પબ્લીક સેક્ટર (૩) બેંકો (૪) અન્યો	૬,૮૨,૬૦,૩૫,૭૬૧ - - ૬,૮૧,૬૩,૬૫૭	૬,૭૭,૧૩,૪૮,૫૮૫ - - ૩૩,૨૯,૪૮,૦૬૩
	સરવાળો (૧)	૬,૮૯,૪૧,૯૯,૪૧૮	૭,૧૦,૪૨,૯૬,૬૪૮
	૨. ભારત બહાર ધિરાણો (૧) બેંકો પાસે લેણા (૨) અન્યો પાસે લેણા (અ) ખરીદેલા અને વટાવેલા બીલો (બ) સીન્ડીકેટ લોન (ક) અન્યો	- - - - -	- - - - -
	સરવાળો (૨)	-	-
	એકંદર સરવાળો (ક)(૧ + ૨)	૬,૮૯,૪૧,૯૯,૪૧૮	૭,૧૦,૪૨,૯૬,૬૪૮

તા. ૩૧-૦૩-૨૦૨૨ના રોજ સરવૈયા અંગેના પરિશિષ્ટો

પરિશિષ્ટ - ૧૦
સ્થાવર મિલકતો

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
૧.	જમીન અને મકાન વર્ષની શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો (-) ઘસારો	૧૦,૨૪,૬૧,૨૩૮ - - - ૭૬,૪૨,૪૨૪	૧,૦૦,૪૭,૬૧૪ - ૯,૨૭,૨૪,૩૮૬ - ૩,૧૦,૭૬૨
	વર્ષાંતે આખર બાકી	૯,૪૮,૧૮,૮૧૪	૧૦,૨૪,૬૧,૨૩૮
૨.	અન્ય સ્થાવર મિલકતો વર્ષની શરૂઆતની બાકી (+) વર્ષ દરમિયાન વધારો (-) વર્ષ દરમિયાન ઘટાડો (-) ઘસારો	૧,૭૯,૨૮,૦૭૫ - ૫૪,૨૩,૦૮૦ ૧,૭૦,૭૨૫ ૩૪,૭૨,૧૭૩	૧,૯૦,૬૭,૬૧૮ - ૧૯,૯૮,૧૨૮ ૧,૧૨,૧૨૮ ૩૦,૨૫,૫૪૩
	વર્ષાંતે આખર બાકી	૧,૯૭,૦૮,૨૫૭	૧,૭૯,૨૮,૦૭૫
	સરવાળો (૧ + ૨)	૧૧,૪૫,૨૭,૦૭૧	૧૨,૦૩,૮૯,૩૧૩

પરિશિષ્ટ - ૯
અન્ય મિલકતો

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
૧.	ઇન્ટર બ્રાંચ એડજસ્ટમેન્ટ (નેટ)	૩,૨૫,૪૬,૬૧૪	૩,૩૭,૪૬,૪૪૯
૨.	મળવાપાત્ર વ્યાજ	૪,૭૧,૦૩,૯૩૯	૩,૬૬,૪૬,૯૮૪
૩.	અગાઉથી ચૂકવેલ ઇન્કમેટેક્સ / ટી.ડી.એસ.	૫,૫૧,૬૮,૦૫૧	૫,૬૦,૮૦,૪૦૩
૪.	સ્ટેશનરી અને સ્ટેમ્પ્સ	૪,૩૪,૦૭૧	૪,૫૫,૮૫૯
૫.	દાવાઓ પેટે પ્રાપ્ત કરેલ નોન બેંકીંગ અસ્કયામતો	-	-
૬.	અન્ય	૧,૦૦,૭૩,૩૬,૫૪૫	૩૮,૬૮,૭૫,૩૭૭
	સરવાળો	૧,૧૪,૨૫,૮૯,૨૧૯	૫૧,૩૮,૦૫,૦૭૧

તા. ૩૧-૦૩-૨૦૨૨ના રોજ સરવૈયા અંગેના પરિશિષ્ટો

પરિશિષ્ટ - ૧૨
આકસ્મિક જવાબદારીઓ

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
૧.	બેંક સામે કલેઈમ થયેલ હોય પણ બેંકે ન સ્વીકારેલ જવાબદારીઓ (અનિર્ણિત ૩ કેઈસ કે જેની નાણાકીય જવાબદારી નક્કી થઈ શકેલ નથી)		
૨.	અંશતઃ ચૂકવેલ રોકાણની જવાબદારી		
૩.	ફોરવર્ડ એક્સચેન્જ કોન્ટ્રાક્ટને કારણે ઉભી થયેલી જવાબદારી		
૪.	સંસ્થાઓ વતી આપેલ ગેરંટી (અ) ભારતમાં (બ) ભારત બહાર		
૫.	સ્વીકૃતિ, એન્ડોર્સમેન્ટ તથા અન્ય ઋણ,		
૬.	બેંકની આકસ્મિક જવાબદારી ઉભી થતી હોય તેવી અન્ય બાબતો. (અ) ઇન્કમટેક્સ ડીરખ્યુટેડ ડીમાન્ડ (બ) મંડળીઓના સભ્યોનું ફડચા લેણાં બેંક એસાઈનમેન્ટ (ક) ગોણા રાજ્ય ભાગીદારી ફંડ (કોન્ટ્રા) (ડ) બીલ્સ રીસીવેબલ (કોન્ટ્રા) (ઈ) થાપણદારોને ચુકવવાપાત્ર (DEAF) (કોન્ટ્રા)	૨૨,૭૨,૪૭૮ ૧૫,૦૧,૨૭૦ ૧૯,૮૯૮ ૫૨,૩૯,૩૦૦	૨૨,૭૨,૪૭૮ ૧૫,૦૧,૨૭૦ ૧,૫૮,૧૬૨ ૩૧,૧૪,૦૨૮
	સરવાળો	૯૦,૩૨,૯૪૬	૭૦,૪૫,૯૩૮

તા. ૩૧-૦૩-૨૦૨૨ના રોજ સરવૈયા અંગેના પરિશિષ્ટો

પરિશિષ્ટ - ૧૩

મળેલ વ્યાજ

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
૧.	ઘિરાણો/બિલ્સ ઉપરનું વ્યાજ/ડીસ્કાઉન્ટ	૬૭,૯૮,૭૯,૨૭૫	૭૨,૫૮,૩૩,૦૬૮
૨.	રોકાણો ઉપરની આવક	૧૧,૧૪,૮૪,૯૮૨	૯,૬૫,૨૯,૮૪૬
૩.	થાપણઓ (બેંકોમાં મુકેલ) ઉપરનું વ્યાજ	૧,૩૫,૩૩,૩૭૩	૫૯,૪૫,૪૦૫
૪.	આર.બી.આઈ.માં રહેલ પુરાંત તથા ઇન્ટર બેંક ફંડ ઉપરનું વ્યાજ.		
૫.	અન્ય		
	સરવાળો	૮૦,૪૮,૯૭,૬૩૦	૮૨,૮૩,૦૮,૩૧૯

પરિશિષ્ટ - ૧૪

અન્ય આવક

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
૧.	કમીશન, વિનિમય અને દલાલી.	૧૨,૬૮,૧૨૮	૮,૬૮,૧૧૦
૨.	રોકાણોના વેચાણ પરનો નફો. બાદ : રોકાણોના વેચાણ પરની ખોટ		
૩.	રોકાણોના પુનઃ મૂલ્યાંકન પરનો નફો બાદ : રોકાણોના પુનઃ મૂલ્યાંકન પરની ખોટ		
૪.	જમીન, મકાન અને અન્ય મિલ્કતોના વેચાણ પરનો નફો બાદ : મકાન અને અન્ય મિલ્કતોના વેચાણ પરની ખોટ	- ૧,૦૨,૦૨૫	- ૬૧,૧૨૮
૫.	એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન પરનો નફો. બાદ : એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન પરની ખોટ		
૬.	ભારત કે ભારત બહારની સબસીડીયરીઝ, કંપનીઓ અને/અથવા સંયુક્ત સાહકોના ડિવિડન્ડ વિ.ની આવક	૨૨,૮૧,૭૬૧ ૨,૧૮,૨૬,૨૩૨	૨,૨૨,૧૧૫ ૨,૦૧,૬૧,૫૧૯
૭.	પરચૂરણ આવક		
	સરવાળો	૨,૫૨,૭૪,૦૯૬	૨,૧૧,૯૦,૬૧૬

તા. ૩૧-૦૩-૨૦૨૨ના રોજ સરવૈયા અંગેના પરિશિષ્ટો

પરિશિષ્ટ - ૧૫

ચૂકવેલ વ્યાજ

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
૧.	ઘાપણો ઉપરનું વ્યાજ	૩૫,૧૮,૧૦,૫૨૮	૩૫,૩૯,૬૦,૯૧૭
૨.	આર.બી.આઈ./ઈન્ટર બેંક કરજ ઉપરનું વ્યાજ	૮,૪૪,૫૩,૧૮૧	૧૦,૪૮,૪૭,૯૭૦
૩.	અન્ય	-	-
	સરવાળો	૪૩,૬૨,૬૩,૭૦૯	૪૫,૮૮,૦૮,૮૮૭

પરિશિષ્ટ - ૧૬

કાર્યકારી ખર્ચાઓ

અનુ.નં.	વિગત	તા. ૩૧-૦૩-૨૦૨૨ની સ્થિતિએ રૂ. પૈસા	તા. ૩૧-૦૩-૨૦૨૧ની સ્થિતિએ રૂ. પૈસા
૧.	કર્મચારીઓને ચૂકવેલ પગાર તથા તે અંગેની જોગવાઈઓ	૧૮,૬૫,૭૦,૭૭૪	૧૯,૫૨,૫૯,૧૧૯
૨.	ભાડું, વેરા તથા વિજળી વપરાશ	૫૫,૩૮,૩૮૨	૩૯,૨૭,૮૬૦
૩.	પ્રિન્ટીંગ અને સ્ટેશનરી	-	-
૪.	જાહેર ખબર	૨,૩૨,૫૧૫	૫,૬૯૨
૫.	બેંક મિલકતો પરનો ધસારો	૧,૧૧,૧૪,૫૯૭	૩૩,૩૬,૩૦૫
૬.	ડિરેક્ટરના ફીઝ - ભથ્થા અને ખર્ચાઓ	૪૪,૬૧૬	૯,૭૭૨
૭.	ઓડિટરોની ફી અને ખર્ચાઓ (શાખાના ઓડિટરોની ફીઝ અને ખર્ચાઓ સહિત)	૭,૫૯,૬૫૦	૨,૯૬,૦૫૦
૮.	વકીલાત ફી	૨,૦૭,૯૩૩	૧૯,૦૦,૭૮૫
૯.	ટપાલ, તાર, ટેલિફોન વી.	૧૧,૫૬,૦૮૪	૧૦,૦૭,૦૦૬
૧૦.	મરામત અને નિભાવ	૮,૨૬,૪૬૭	૫,૦૫,૧૪૪
૧૧.	વિમો	૧,૪૦,૨૪,૭૪૧	૯૩,૮૧,૮૩૫
૧૨.	અન્ય ખર્ચાઓ	૧,૦૯,૧૫,૮૩૧	૧,૩૭,૩૦,૩૮૦
	સરવાળો	૨૩,૧૩,૯૧,૫૯૧	૨૨,૯૩,૫૯,૯૪૮

	પ્રોવિઝનો અને કન્ટ્રીજન્સીઝ		
૧.	ઈન્કમેટેક્સનું પ્રોવિઝન	૧૨,૦૦,૦૦૦	૪,૫૯,૦૦,૦૦૦
૨.	ખિજાણેશ પ્રમોશન અંગેનું પ્રોવિઝન	૨૨,૦૦,૦૦૦	૨૦,૦૦,૦૦૦
૩.	સ્ટાફ ફોન્ડ અંગેનું પ્રોવિઝન	૩,૧૮,૦૨,૪૧૭	-
૪.	ચૂકવવાપાત્ર ઓડીટ ફીનું પ્રોવિઝન	૫,૦૦,૦૦૦	૫,૦૦,૦૦૦
૫.	ચૂકવવાપાત્ર હકક રજાનું પ્રોવિઝન	૧,૧૨,૬૧,૧૩૭	-
૬.	ઈન્વેસ્ટમેન્ટ ફલકયુએશન અંગેનું પ્રોવિઝન	-	૪૬,૯૬,૦૭૧
૭.	ચૂકવવાપાત્ર બોનસ અંગેનું પ્રોવિઝન	-	-
૮.	પ્રમાણભૂત અસ્કયામતો સામેનું પ્રોવિઝન	-	-
૯.	બેંક એન્ડ કાઉન્ટર ડેબ્ટ્સ રીઝર્વ ફંડ	૨,૯૦,૦૦,૦૦૦	૧૦,૫૦,૦૦,૦૦૦
૧૦.	ઓવરડ્યુ ઇન્ટરેસ્ટ રીઝર્વ ફંડ	-	૮,૮૭,૫૧૯
૧૧.	પ્રોવીઝન ફોર બ્રાંચ એડજસ્ટમેન્ટ	૨,૭૪,૭૫,૬૪૫	-
૧૨.	પ્રોવીઝન ફોર સન્ટ્રી ડેટર્સ	૩૫,૧૪,૨૮૪	-
૧૩.	બેંક એન્ડ કાઉન્ટર ડેબ્ટ્સ ફોર રૂરલ એડવાન્સીઝ	૫,૩૦,૦૦,૦૦૦	-
	સરવાળો	૧૫,૯૯,૫૩,૪૮૩	૧૫,૮૯,૮૩,૫૯૦

Accounting Policies

1 AS-1 Disclosure of accounting policies :-

a. Accounting Convention :

The accompanying financial statements have been prepared under the historical cost convention. They conform to Generally Accepted Accounting Principles (GAAP) In India, which comprise the statutory provisions, guidelines of regulatory authorities, Reserve Bank of India (RBI), NABARD, accounting standards/guidance notes issued by the Institute of Chartered Accountants of India (ICAI), and the practices prevalent in the banking industry in India.

b. Use of Estimates :

The preparation of financial statement required the management to make estimates and assumptions considered in the reported amounts of assets and liabilities (including contingent liabilities) as of the date of the financial statements and the reported income and expenses during the reporting period. Management believes that the estimates used in the preparation of the financial statement are prudent and reasonable. Future results could differ from these estimates. Any revision to the accounting estimates is recognized prospectively in the current and future periods.

2 AS-3 Cash Flow Statement :-

Cash Flow Statement is worked out as per Indirect Method specified under AS-3 issued by ICAI.

3 AS-4 Contingencies and Events Occuring After the Balance Sheet Date

Material adjusting events (that provides evidence of condition that existed at the balance sheet date) occurring after the balance sheet date are recognized in the financial statements. Non adjusting events (that are indicative of conditions that arose subsequent to the balance sheet date) occurring after the balance sheet date represents material change and commitment affecting the financial position are disclosed in the reports of the Board of Directors.

4 AS-5 Net Profit or Loss for the period, Prior Period items and changes in accounting Policies

Material items of prior period, non-recurring and extra ordinary items are shown separately, if any.

5 AS-9 Revenue Recognition :-

Income / Expenditure are accounted on accrual basis except the following which are accounted for on cash basis

(a) Income :

- i interest and other income on non Performing Assets are recognized as per RBI guidelines Except not provided below.
- ii Commission (except commission on insurance)
- iii Locker Rentals
- iv Dividend on Investments

(b) Expenditure :

- i Insurance Premium
- ii Legal Charges, Postage & Telegram and other expenses.
- iii MICR Clearing charges.
- iv Computer repairing expenses.
- v Leave Encashment Expenditure
- vi Interest paid on overdue fixed deposits on renewal (if any).

5 AS-10 Accounting for Fixed Assets :-

Fixed assets are stated at their historical cost or revalued value which ever is higher, less accumulated depreciation. Cost comprises the purchase price and any other attributable cost of bringing the asset to its working condition for its intended use.

Depreciation accounting :-

- (A) Premises and other fixed assets (including land wherever the cost of land is not segregated) are depreciated on written down value method at the following rates.

Particulars	Rate of Depreciation
Land	Zero
Building (Office & Commercial)	10%
Furniture - Fixture	10%
Other Equipments (Office)	15%
Electric Equipments	10%
Vehicle (All)	15%
In case of computer (Hardware & Software) depreciation is calculated on straight-line basis @ 1/3 of cost of asset.	

- (B) depreciation on fixed assets purchased during the year is charged for the entire year if the assets are purchased and retained before the 180 days or more. Otherwise it is charged at 50% of the normal rate. No depreciation is charged on fixed assets sold on or before 30th September and depreciation @ 50% of the normal rate is provided for assets sold after 30th September.

7 AS-12 Accounting for Government Grants

Governments and other grants related to fixed assets has been deducted from the relevant fixed assets and any revenue grants if any has been charged to profit and loss accounts

8 AS-13 Accounting for Investments :-

Investments are accounted for in accordance with the extant regulatory guidelines. The bank follows trade date method for its investments.

- (A) **Classification : Investments are classified under three categories like;**

- Held to Maturity
- Available for Sale
- Held for Trading

Under each of these categories, investments are further classified into the following 6 groups:

- Government Securities
- Other Approved Securities
- Shares
- Debentures and Bonds
- Subsidiaries / Joint Ventures
- Others

(B)

Basis of classification :

- i Investments that the Bank intends to hold till maturity is classified as Held to Maturity.
- ii Investments that are held principally for resale within 90 days from the date of purchase are classified as held for Trading.
- iii Investments, which are not classified in the above two categories, are classified as Available for Sale.
- iv An investment is classified as held to Maturity, Available for Sale or Held for Trading at the times of its purchase and subsequent shifting amongst categories is done in conformity with regulatory.
- v Investments in subsidiaries, joint ventures and associates are classified under as Held to Maturity.

(C)

Valuation

- i In determining the acquisition cost of an investment :
 - a (a) Brokerage / commission / securities transaction tax received / paid on subscriptions is adjusted from the cost.
 - b (b) Brokerage, commission, etc.. paid in connection with acquisition of investment are expensed upfront and excluded from cost.
 - c (c) Broken period interest paid / received on investment is treated as interest Expense / income and is excluded from cost / sale consideration.
 - d (d) The transfer of a security amongst the above three categories is accounted for at the least of acquisition cost / book value / market value on the date of transfer, and the depreciation, if any, on such transfer is fully provided for.
- ii Held to Maturity category : Each scrip under Held to Maturity category is carried At its acquisition cost or at amortized cost, if acquired at a premium over the face Value. Any premium on acquisition is amortized over 10 years from the year of purchase or period remaining to maturity whichever is less. However, during the year Remaining balance of premium on acquisition of "Held to Maturity" category of Investment is charged to Profit & loss account. A provision is made for diminution, other than temporary.
- iii Available for sale and Held for Trading categories: Each scrip in the above two categories is revalue at the market price of fair value determined as per Regulatory Guidelines, and only the net depreciation of each group for category is provided for Net appreciation, is ignored, On provision for depreciation the book value of the individual securities remains unchanged after marking to market.
- iv Investments are classified as performing and non- performing, based on the guidelines issued by the RBI. Investment become non performing where :
Investment / instalment (including maturity proceeds) is due and remains unpaid for more than 90 days.

9 AS-15 Employees Retirement Benefit Plan :-

Employee Benefits :

- a Short Term Employee Benefits

All employee benefits payable wholly within twelve months of rendering the service are Classified as short- term employee benefits such as salaries, wages etc., and the expected Cost of bonus, ex - gratia are recognized in the period in which the employee renders the related service.

- (b) Post Employment Benefits :
- i Defined Contribution Plans :
State Governed Provident fund scheme and employees state insurance scheme are defined Contribution plans. The contribution paid / payable under the schemes is recognized during the period in which the employee renders the related services.
- ii Defined Benefits Plans :
The employee's gratuity fund scheme and Group Leave Encashment Scheme is Bank's Defined Benefits Plans.

Gratuity

The bank has tied with the LIC for Employee's gratuity but the provision of same has not been recognised in the profit and loss account as per actuarial valuation as prescribed by the Accounting Standard 15 issued by the ICAI and provision of the same has been charged to the Profit and Loss account on the basis of actual payment made to the LIC.

Leave Encashment :-

The bank has not made any arrangement for meeting the future liability of Leave Encashment (At the time of Retirement), the same has been paid to the employees at the time of retirement on payment basis and charged to the profit and loss account for the period in which the payment is made.

10 AS-17 Segment Reporting :-

The Bank's Operations are solely in the Banking Services Industry Including Investment. As the entire income revolves around banking operations, and where major investments are made for compliance of banking regulations, separate segment reporting as per Accounting Standard - 17 is not considered necessary.

11 AS-29 Provisions, Contingent liabilities and contingent assets :-

- (A) In conformity with AS 29, "Provision, contingent Liabilities and Contingent Assets", Issued by the Institute of Chartered Accountants of India, the Bank recognizes provisions only when it has a present obligation as a result of a past event, it is a probable that a outflow of resources embodying economic benefits will be required to settle the obligation, and when a reliable estimate of the amounts of the obligation can be made..
- (B) No provision is recognized for
- i Any possible obligation that arises form past events and the existence of which will be confirmed only by the occurrence or non- occurrence of one or more uncertain future events not wholly withing the control of the bank ; or
- ii Any present obligation that arises form past events but is recognized because
- a It is not probable that an outflow of resources embodying economic benefits will be required to settle the obligation ; or
- b Reliable estimate of the amount of obligation cannot be made.

Such obligations are recorded as Contingent Liabilities. These are assessed at regular intervals and Only that part of the obligation for which an outflow of resources embodying economic benefits is probable, is provided for, except in the extremely rare circumstances where no reliable estimate can be made.



જામનગર ડીસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક લી., જામનગર

- (C) Contingent Assets are not recognized in the financial statements as this may result in the recognition of income that may never be realized.

ADVANCES

- (A) Advances are classified as performing and non-performing as per guidelines prescribed by RBI except as given in audit Report and are shown to gross. Provision for non-performing advances is shown under "Reserve Fund and other Reserves."

(B) N.P.A. Provision

Provision for losses made on non-performing advances are on the basis of assets classification and provisioning requirement as per the prudential norms prescribed by the Reserve Bank of India and revised from time to time is as under :

Substandard :	10%
General provision	
Doubtful	
Secured Portion :	
i Up to one year	20%
ii One to three years	30%
iii More than three years	100%
Unsecured portion	100%
Loss Assets	100%

- (C) The overdue interest in respect of advances is provided separately under "Overdue Interest Reserve" as per the directive issued by the Reserve Bank of India.
- (D) The provision made for standard advances (performing) in terms of RBI guidelines is however, included in "other liabilities".
- (E) Additional provisions carried on accounts over and above requirements under the prudential norms prescribed by the Reserve Bank of India, which can be considered as earmarked reserves is as follows :
Bad & doubtful debts provision for rural advance.

For S C Makhecha & Associates

Chartered Accountants

Sd/-

Vipul Dattani

Partner

M. No. 115544

F. R. No. 120184W

Signed on : 31/05/2022 At Jamnagar

UDIN : 22115544AKIEXB9733

For, Jamnagar District Co. Operative Bank Ltd.

Sd/-

(P. S. ROLA)

General Manager

(Incharge)

Sd/-

(J. V. NANDASANA)

Manager Accounts R

(Incharge)

1. Sd/- Shri Pratapsinh Sidubha Jadeja
2. Sd/- Shri Rajeshbhai Bhikhabhai Vadi
3. Sd/- Shri Lunabha Patramalbhahi Sumaniya
4. Sd/- Shri Mulubhai Hardasbhai Bera
5. Sd/- Shri Pravinsinh Hematsinh Zala
6. Sd/- Shri Jivanbhai Karubhai Kumbharvadiya

7. Sd/- Shri Hemntbhai Hardasbhai Khava
8. Sd/- Shri Meragbhai Kanabhai Chavda
9. Sd/- Shri Baldevsinh Pravinsinh Jadeja
10. Sd/- Shri Dharamsinh Ramjibhai Chaniyara
11. Sd/- Shri Hasmukhbhai Mansukhbhai Moliya
12. Sd/- Shri Jigarbhai Rameshbhai Kundaliya

૨૦૨૨

31

• NOTES TO ACCOUNTS •

- The bank was registered on 15.05.1959 and commenced its banking business on 26.03.1960. The Reserve Bank of India has issued license to the bank on 22.02.2010 and revised license was issued to the bank on 25.06.2012 which specified the area of operation of the bank is Jamnagar district. Area of operation of the bank is Jamnagar District, Devbhumi Dwarka District and Morbi district due to reconstitution of Jamnagar District.
- Under normal business transactions the bank has sanctioned loans to the Primary Agriculture Co. Op. Society (PACS).
- Bank has paid DICGC premium of Rs. 1,03,17,087/- for the year ending on 31.03.2022
- Fixed Assets is required to be shown at Gross Block as per AS-10 but in the financial statements it is shown at Net Block.
- As per bye laws, Bank has a Practice of Appropriation of Profit only after approval in the General Body Meetings. As a consequence they propose appropriation in the respective year & provide the same in the next year for distribution proposes. Current year Proposed Distribution is as under :

Proposed Appropriations		From the Profit 21-22
Transfer to Statutory Reserves	25%	6,40,736
Transfer to Other Reserves		
Transfer to :		
Agricultural Credit Stabilisation Fund	15%	3,84,441
Special Bad Debts Reserve Fund Sec. 67C	15%	3,84,441
Building Fund	45%	11,53,324
Total		25,62,943

- Interest Income
Interest Subvention receivable For the Financial Year 2021-22 amounting Rs. 2181.50 Lacs. is credited as a interest income in the profit and loss account.
 - Defined Contribution Plans :
Amount of Rs. 196.84 lacs (P. Y. 178.16 lacs) is recognized as charges and included in "Profit and Loss Account" (Schedule - 16) in the profit and Loss Account.

Notes :

The Bank provides retirement benefits in the form of Provident Fund and Gratuity. Provident fund contributions made to "Government Administrated Provident Fund" are treated as defined contribution plan, since the Bank has no further obligations beyond its monthly contributions.

- Bank has not followed the AS-22 Accounting for taxes on Income.



9 Investment

Particulars	2021-22	2020-21
Value of Investment	1,50,17,17,581	1,40,22,69,509
Gross Value of Investment	1,50,17,17,581	1,40,22,69,509
Provision for Depreciation	-	-
Net Value of Investment	1,50,17,17,581	1,40,22,69,509
Movement of provisions held	-	-
towards depreciation on investments	-	-
Opening Balance	-	-
Add: Provisions made during the year	-	-
Less: Write-off / write-back of excess	-	-
provisions during the year	-	-
Closing Balance	-	-

10 "Notes on Account" of the Balance Sheet Disclosure of additional information.

a "Notes on Account of the Balance Sheet in respect of Non-SLR Investment Portfolio as on 31.03.2022

(Rs. in Lacs)

Issuer	Amount	Extent of Private Placement	Extent of below Investment Grade securities Already invested	Extent of Unlisted Securities
P.S.U.s.	-	-	-	-
F.I.S.	-	-	-	-
Banks	11,244.00	-	-	11,244.00
Shares of Co-operatives	148.57	-	-	148.57
Subsidiaries / Joint Ventures	-	-	-	-
Others	-	-	-	-
Less :- Provision held towards Depreciation	-	-	-	-
TOTAL	11,392.57	-	-	11,392.57

NON PERFORMING NON - SLR INVESTMENTS

AMT. (in lacs)

Particulars	AMT. (in Lakhs)
Opening Balance	-
Addition during the above period	-
Reductions during the above period	-
Closing Balance	-
Total provisions held	-

b Details of Non-Performing financial assets purchased / sold :

1 Details of Non-Performing financial assets purchased :

Particulars	2021-22	2020-21
No. of accounts purchased during the year	-	-
Aggregate outstanding	-	-
Of these, number of account restructured during the year	-	-
Aggregate outstanding	-	-

2 Details of Non-Performing financial assets sold :

Particulars	2021-22	2020-21
No. of accounts sold	-	-
Aggregate outstanding	-	-
Aggregate consideration Received / Receivable	-	-

11 DEAF Account Information

Rs. in Lacs

Particulars	2021-22	2020-21
Opening Balance	31.14	31.14
Addition during the above period	21.25	-
Reductions during the above period	-	-
Closing Balance	52.39	31.14

12 Inter Bank / Branch Reconciliation :-

Inter Bank / Branch reconciliation has not been provided to us for verification in case of most of the branches so we are not in a position to comment on the same.

13 Previous year figures are re-grouped / rearranged wherever necessary, to make them comparable with current year's figures.

14 Bank balances are subject to confirmation / reconciliation (if any)

15 Wherever external evidence in the form of Invoice, cash memo, receipts etc... Not available, reliance is placed on internal vouchers, informations and explanation given by the management.

General Information

Particulars	31-03-2022	31-03-2021
1 Investments Permonent - (only SLR - with break up under permanent and current category/ under current category with the following break up)		
(a) Book Value	14,868.60	13,874.12
(b) Face Value of the Investments	14,934.90	13,888.76
(c) Market Value of Investments	15,513.38	14,675.61
2 Advances to Directors, their relatives, companies/firms in which they are interested.		
(a) Fund based	0.00	0.00
(b) Non Fund based (Guarantees, L/C etc.)	-	-
3 Cost of Deposits - Average cost of Deposits	3.83%	4.33%
4 Non Performing Assets (NPA)		
(a) Gross NPAs	11,838.46	10,932.19
(b) Net NPAs	-	-
(c) Percentage of Gross NPAs to total Advances	17.30%	15.71%
(d) Percentage of net NPAs o net advances	0.00%	0.00%
5 Movement of Non Performing Assets		
Opening Balance	10,932.19	10,982.24
Addition during the year	1,238.72	803.34
Deduction During the year	332.45	853.39
Closing Balance	11,838.46	10,932.19
Less: Interest debited to Loan Account	-	-
Net Closing Balance	11,838.46	10,932.19
6 Provisions :		
(a) Provisions on NPAs required to be made	10,764.45	8,832.45
(b) Provisions on NPAs actually made	11,482.37	8,842.37
(c) Provisions required to be made in respect of overdue Interest taken into income account, gratuity fund, provident fund, arrears in reconciliation of inter-branch account, income tax imbalance etc.	1,094.91	2,628.62
(d) Provisions actually made in respect of overdue interest taken into income account, gratuity fund, provident fund arrears in reconciliation of inter - branch account tax imbalance etc.	2,090.10	2,628.62
(e) Provisions required to be made on depreciation in investments.	-	-
(f) Provisions actually made on depreciation in investments	-	-

7 Movement in provision		
(a) towards NPAs	290.00	1,050.00
(b) Towards depreciation of Provision	-	-
(c) Towards Standard Assets.	-	-
(d) Towards all others items under 7 above (gratuity, Imbalance & Income Tax etc.	12.00	459.00
8 Payment of Insurance premium to the DICGC, including arrears, if any	103.17	90.84
9 Penalty (INTEREST) imposed by RBI for any violation.	-	-
10 Information on extent of arrears in reconciliation of inter-bank and inter-branch accounts (Pending entry more than six months)	AS PER THE NOTE GIVEN IN NOTES ON ACCOUNTS	AS PER THE NOTE GIVEN IN NOTES ON ACCOUNTS
11 Capital to Risk Weighted Assets Ration (CRAR)	11.55%	11.60%

CAPITAL

Sr.No.	Particulars	31-03-2022	31-03-2021
I)	CRAR (%)	11.55%	11.60%
II)	Percentage of Shareholding :		
	Pacs/Co-Operative Societies	99.96%	99.96%
	Nominal Members	0.04%	0.04%

ASSET QUALITY

NON PERFORMING ASSETS

Sr.No.	Particulars	31-03-2022	31-03-2021
I)	Net NPAs to Net Advances (%)	0.00%	0.00%
II)	Movement of NPAs (Gross)		
(a)	Opening Balance	10,932.19	10,982.24
(b)	Additions during the year	1,238.72	803.34
(c)	Reductions during the year	332.45	853.39
(d)	Closing Balance	11,838.46	10,932.19
(e)	Interest Included in above closing balance	-	-
(f)	Net Closing Balance	11,838.46	10,932.19

III) Movement of Net NPAs		
(a) Opening Balance	-	3,088.92
(b) Additions during the year	-	-
(c) Reductions during the year	-	-
(d) Balance of Reserve for Bad & doubtful Debt Rural advance considered for Net NPA	-	3,088.92
(e) Closing Balance	-	0.00
IV) Movement of Provision for NPAs (excluding provisions on standard assets)		
(a) Opening Balance	8,689.70	7,639.70
(b) Provisions made during the year	290.00	1,050.00
(c) Write off / write back of excess provisions		
(d) Closing Balance	8,979.70	8,689.70

Sr.No.	Particulars	31-03-2022	31-03-2021
I)	Total amount of loan assets subjected to restructuring, rescheduling, renegotiation.	NIL	NIL
II)	Total amount of Standard assets subjected to restructuring, rescheduling, renegotiation.	NIL	NIL
III)	Total amount of Sub Standard assets subjected to restructuring, rescheduling, renegotiation.	NIL	NIL
IV)	Total amount of Doubtful assets subjected to restructuring, rescheduling, renegotiation.	NIL	NIL

Details of financial assets sold to Securitisation / Reconstruction Company for asset Reconstruction.

Sr.No.	Particulars	31-03-2022	31-03-2021
I)	No. of Accounts	NIL	NIL
II)	Aggregate value (net of provisions of accounts sold to SC/RC.)	NIL	NIL
III)	Aggregate Consideration	NIL	NIL
IV)	Additional consideration realized in respect of accounts transferred in earlier years	NIL	NIL
V)	Aggregate gain/loss over net book value.	NIL	NIL

Details of Non-Performing financial assets purchased / sold:

A. Details of Non-Performing financial assets purchased :

Sr.No.	Particulars	31-03-2022	31-03-2021
I	(a) No. of accounts / purchased during the year	NIL	NIL
	(b) Aggregate outstanding	NIL	NIL
II	(a) Of these, number of account restructured during the year	NIL	NIL
	(b) Aggregate outstanding	NIL	NIL

B. Details of Non-Performing financial assets sold :

Sr.No.	Particulars	31-03-2022	31-03-2021
1	No. of accounts sold	NIL	NIL
2	Aggregate outstanding	NIL	NIL
3	Aggregate consideration received	NIL	NIL

Business Ratio (profitability)

Sr.No.	Particulars	31-03-2022	31-03-2021
1	Interest Income as a percentage to Working Fund.	7.06%	7.86%
2.	Non Interest Income as a percentage to Working Fund.	0.22%	0.20%
3.	Operating Profit as a percentage to Working Fund.	1.43%	1.20%
4.	Return on Assets	0.02%	0.02%
5.	Average Business (Deposits plus Advances) per employee (306/314)	517.11	488.80
6	Profit per employee (306/314)	0.08	0.08

Commission Business

Sr.No.	Particulars	31-03-2022	31-03-2021
1	From Life Business	3,94,934	2,78,780
2	From Non Life Business	-	-
	Total	3,94,934	2,78,780

THE JAMNAGAR DISTRICT CO-OPERATIVE BANK LTD., JAMNAGAR Cash Flow Statement for the Year Ended 31/03/2022

Particulars	March 31, 2022		March 31, 2021	
A CASH FLOW FROM OPERATING ACTIVITIES				
Net Profit After Tax & Extra Ordinary Items		25,62,942.92		23,46,510
Adjusted For :				
Depreciation	1,11,14,597.00		33,36,305	
Bad & Doubtful Debts for Rural Advance				
Bad & Doubtful Debts Reserve Fund	2,90,00,000		10,50,00,000	
Provision for Standard Loans and Advances				
Fixed Assets Written off/Loss/(Profit) on sale of assets	1,02,025		61,128	
Profit on Sale of Investment				
Security Premium Amortised				
Deferred Tax Assets As on 01/04/2007				
Reduction in Transitional Liability Of Gratuity & Leave Encashment				
Provision For Overdue Interest Reserve				
Provision For Interest Rebate on KCC 2008-09				
Deferred Tax Assets Reversed				
Profit on Sale of Assets				
Profit/Loss on sale of Investments		4,02,16,622		10,83,97,433
Operating profit before changes in operating assets & liabilities		4,27,79,565		11,07,43,943
Adjusted for :				
Decrease / (Increase) in Current Assets	-62,87,84,148		-12,93,04,561	
Increase / (Decrease) in Current Liabilities	1,25,09,149		-44,25,922	
Movements in Investments (Net)	-9,94,48,072		-19,68,41,430	
Movement in Borrowings (Net)	1,99,07,53,949		1,82,36,405	
Movement in Advances (Net)	21,00,97,229		20,28,44,637	
		1,48,51,28,108		-10,94,90,870
Cash Generated From Operations		1,52,79,07,673		12,53,072
Less :				
Direct Taxes Paid				
Cash Flow Before Extra-ordinary Items		1,52,79,07,673		12,53,072
Adjusted for Extra-ordinary Items				
Cash Flow from Operating Activities		1,52,79,07,673		12,53,072
B Cash Flow From Investing Activities				
Purchase of Fixed Assets	-54,23,080		-9,47,22,514	
Sale of Fixed Assets	68,700		51,000	
Net Cash Flow Investing Activities		-53,54,380		-9,46,71,514
C Cash Flow From Financing Activities				
Proceeds From Issue of Share Capital Including Premium				
Dividend Paid				
Movements in Reserve Fund	8,48,02,417		9,74,20,457	
Net Cash Flow from Financing Activities		8,48,02,417		9,74,20,457
Net Cash Flow During th Year (A + B + C)		1,60,73,55,710		40,02,015



ધી જામનગર ડીસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક લી., જામનગર

THE JAMNAGAR DISTRICT CO-OPERATIVE BANK LTD., JAMNAGAR Cash Flow Statement for the Year Ended 31/03/2022

Particulars	March 31, 2022	March 31, 2021
Opening Balance of Cash and Cash Equivalents	82,20,26,056	81,80,24,041
Closing Balance of Cash and Cash Equivalents	2,42,93,81,766	82,20,26,056
Cash/Cash Equivalents at the Beginning of the Year:		
(a) Cash on Hand	56,72,31,331	13,75,13,703
(b) Balance with Banks		
In RBI/Apex banks		
In Current Account	25,03,94,725	39,61,10,338
In Fixed Deposit Account	44,00,000	28,44,00,000
(c) Money at Call & Short Notice	82,20,26,056	81,80,24,041
Cash/Cash Equivalents at the End of the Year:		
(a) Cash on Hand	86,76,51,352	56,72,32,331
(b) Balance with Banks		
In RBI/Apex banks		
In Current Account	43,73,30,414	25,03,94,725
In Fixed Deposit Account	1,12,44,00,000	44,00,000
(c) Money at Call & Short Notice	2,42,93,81,766	82,20,26,056

Note : (1) The Cash Flow Statement has been prepared under indirect method as set out in AS-3 "Cash Flow Statement" issued by ICAI.
(2) Figures of the previous year have been regrouped where ever necessary, to compare with current year figures.

For Accounting Policies and Notes on Accounts Place refer Separate Schedule Attached.

As per our report of even date

For S C Makhecha & Associates
Chartered Accountants

Sd/-

Vipul Dattani

Partner

M. No. 115544

F. R. No. 120184W

Date : 31/05/2022 At Jamnagar

UDIN : 22115544AKIEXB9733

For, Jamnagar District Co. Operative Bank Ltd.

Sd/-

(P. S. ROLA)
General Manager
(Incharge)

Sd/-

(J. V. NANDASANA)
Manager Accounts R
(Incharge)

1. Sd/- Shri Pratapsinh Sidubha Jadeja
2. Sd/- Shri Rajesh Bhikhabhai Vadi
3. Sd/- Shri Lunabha Patramalbhai Sumaniya
4. Sd/- Shri Mulubhai Hardasbhai Bera
5. Sd/- Shri Pravinsinh Hematsinh Zala
6. Sd/- Shri Jivanbhai Karubhai Kumbharvadliya

7. Sd/- Shri Hemntbhai Hardasbhai Khava
8. Sd/- Shri Meragbhai Kanabhai Chavda
9. Sd/- Shri Baldevsinh Pravinsinh Jadeja
10. Sd/- Shri Dharamsinh Ramjibhai Chaniyara
11. Sd/- Shri Hasmukhbhai Mansukhbhai Moliya
12. Sd/- Shri Jigarbhai Rameshbhai Kundaliya

તા. ૩૧-૦૩-૨૦૨૨ના રોજ જુદા-જુદા પ્રકારના ધિરાણોની માહિતી દર્શાવતું પત્રક

(રકમ રૂ. લાખમાં)

ધિરાણોનો પ્રકાર	કુલ બાકી	તે પૈકી મુદત પિતેલ	ધિરાણોનો પ્રકાર	કુલ બાકી	તે પૈકી મુદત પિતેલ
ખેતિ પિયચક :-			બિન ખેતિ પિયચક :-		
૧. ટુંકી મુદત :-			૧. ટુંકી મુદત :-		
(૧) ટુ.મુ.ખે.પિ. (પાક ધિરાણ)	૬૩,૯૨૨.૧૪	૧૨૮૨૧.૮૭	(૧) ટુ.મુ.રો.શા. હાઈપો ખાતર	૨૦૩.૩૬	૨૦૩.૩૬
(૨) એસાઈનમેન્ટ તથા ફડયાની મંડળીઓ પાસેનું લેણું	૫૦૪.૭૫	૫૦૪.૭૫	(૨) રોકડ શાખા બિન ખે.પિ.હાઈપો.	૩૧૫.૧૨	૨૧૫.૧૩
(૩) એસાઈનડ લેણું (નોમીનલ)	૦.૦૦	૦	(૩) પગારદાર કર્મચારીઓની શરાફી મંડળી	૨૨૩.૯૦	૧૫૫.૫૨
			(૪) માલ તારણ સામે	૩૩.૬૧	૩૩.૬૧
			(૫) હાઉસીંગ મંડળીઓ	૯.૫૬	૯.૫૬
			(૬) કલીન કેશ કેડીટ	૦.૦૧	૦.૦૧
			(૭) સેલ્ફ હેલ્પ ગ્રુપ	૧૬.૮૬	૧૫.૯૩
			(૮) કેશ કેડીટ (સ્ટાફ)	૨૫૩.૭૫	૧૩.૨૪
			(૯) બાંધી મુદત થાપણ, બચતપત્રો, પિ. સામે	૮૫.૭૭	૧.૧૭
			(૧૦) વ્યક્તિ કલીન તથા વ્યક્તિ ઓવરડ્રાફ્ટ	૧૩.૨૩	૧૩.૨૩
			(૧૧) વ્યક્તિ ઓવરડ્રાફ્ટ	૩.૪૩	૩.૪૩
			(૧૨) ચાલુ ખાતા સામે ઓવરડ્રાફ્ટ	૧૯૩.૬૨	૧૭૬.૦૫
			(૧૩) સોનાના દાગીના સામે	૦.૦૦	૦
કુલ :-	૬૪૪૨૬.૮૯	૧૩૩૨૬.૬૨	કુલ :-	૧૩૫૨.૨૨	૮૪૦.૨૪
૧. મધ્યમ મુદત :-			૧. મધ્યમ મુદત :-		
(૧) એસ. જી. એસ. વાચ.	૩.૧૨	૩.૧૨	(૧) નોન ફાર્મ સેક્ટર ધિરાણ		
(૨) ૫ વર્ષ	૨૫૬.૬૪	૨૫.૩૬	(અ) વ્યક્તિઓને	૬૨.૯૯	૬૨.૯૯
(૩) કમ્પર્ઝન	૭૯.૧૯	૭૯.૧૯	(બ) મંડળીઓ મારફત	૫૭.૬૭	૩.૯૭
(૪) રીશેડ્યુલમેન્ટસ	૧૨૮.૭૦	૧૨૮.૭૦	(૨) વાહન લોન (સ્ટાફ)	૦.૫૪	૦.૧
			(૩) વ્યક્તિ હાઈપો.	૭.૬૮	૭.૬૮
			(૪) એ.પી.એમ.સી.	૪૬૪.૬૧	૪૬૪.૬૧
કુલ :-	૪૬૭.૬૫	૨૩૬.૩૭	કુલ :-	૫૯૩.૪૯	૫૩૬.૩૫
૧. લાંબી મુદત :-			૧. લાંબી મુદત :-		
(૧) ટ્રેક્ટર માટેનું ધિરાણ	૭૩.૨૦	૨૭.૨	(૧) સ્ટાફ હાઉસીંગ લોન	૩૪૧.૫૮	૫.૮૮
(૨) કુવા	૨૫૫.૮૧	૧૫.૨૩	(૨) જે.સી.બી. એક્સચેન્જર	૦.૦૦	૦.૦૦
(૩) પાઈપલાઈન	૭૬.૭૨	૨.૨૬			
(૪) ડ્રીપ ઈરીગેશન	૧૩.૫૯	૦			
(૫) જમીન સુધારણા	૧૪૨.૦૪	૯૯.૦૨			
(૬) ખે.પિ. અન્ય ધિરાણ	૬૦.૫૮	૦.૬૨			
(૭) ગોડાઉન ધિરાણ	૧૧૨૦.૮૪	૨૦૬.૨૨			
(૮) બેંકિંગ ધિરાણ	૦.૦૦	૦			
(૯) હાઉસીંગ ધિરાણ	૧૭.૩૮	૦			
કુલ :-	૧૭૬૦.૧૬	૩૫૦.૫૫	કુલ :-	૩૪૧.૫૮	૫.૮૮
એકંદર (૧+૨+૩)	૬૬૬૫૪.૭૦	૧૩૯૧૩.૫૪	એકંદર (૧+૨+૩)	૨૨૮૭.૨૯	૧૩૮૫.૪૭
		(બાકી)			(મુ.પિ. ટકા)
કુલ ધિરાણો (ખે.પિ.+બિન ખે.પિ.) :-	૬૮૯૪૧.૯૯	૧૫૨૯૯.૦૧		૨૨.૧૯	

મુખ્ય ઓફીસ તથા શાખાઓના ટેલીફોન નંબર

જામનગર (ઇ.પી.એ.બી.એક્સ.) ૦૨૮૮
જનરલ મેનેજર ૦૨૮૮

૨૬૭૮૫૦૫/૬/૭/૮/૯
૨૫૭૩૭૦૧ (૨૩ લાઇન્સ)
૨૫૫૪૫૬૭

ક્રમ	શાખાનું નામ	કોડ	ટેલીફોન નંબર
૧	અલીયાબાડા		૬૩૫૭૦ ૯૩૦૦૨
૨	મોટી બાણગાર	૦૨૮૮	૨૮૮૪૨૨૮
૩	બજરંગપુર	૦૨૮૮	૨૮૪૦૨૩૪
૪	હાપા		૬૩૫૭૦ ૯૩૦૦૫
૫	જામજોધપુર		૬૩૫૭૦ ૯૩૦૦૬
૬	સમાણા		૬૩૫૭૦ ૯૩૦૪૧
૭	વાંસજાળીયા		૬૩૫૭૦ ૯૩૦૦૮
૮	સીદસર		૬૩૫૭૦ ૯૩૦૦૯
૯	ભાણવડ		૬૩૫૭૦ ૯૩૦૧૦
૧૦	ઘોલ		૬૩૫૭૦ ૯૩૦૧૧
૧૧	લતીપુર		૬૩૫૭૦ ૯૩૦૧૨
૧૨	ભેંસદડ		૬૩૫૭૦ ૯૩૦૧૩
૧૩	જોડીયા		૬૩૫૭૦ ૯૩૦૧૪
૧૪	બાલંભા		૬૩૫૭૦ ૯૩૦૧૫
૧૫	આમરણ	૦૨૮૯૩	૨૮૭૨૪૮
૧૬	જીરાગઢ	૦૨૮૯૩	૨૯૩૯૯૭
૧૭	મેઘપર	૦૨૮૯૩	૨૪૫૭૧૫
૧૮	ધૂળકોટ	૦૨૮૯૩	૨૯૨૨૧૫
૧૯	હડીયાણા		૬૩૫૭૦ ૯૩૦૨૦
૨૦	પીઠડ		૬૩૫૭૦ ૯૩૦૨૧

ક્રમ	શાખાનું નામ	કોડ	ટેલીફોન નંબર
૨૧	કાલાવડ		૬૩૫૭૦ ૯૩૦૨૨
૨૨	ખંઢેરા		૬૩૫૭૦ ૯૩૦૨૩
૨૩	ખરેડી		૬૩૫૭૦ ૯૩૦૨૪
૨૪	નવાગામ		૬૩૫૭૦ ૯૩૦૨૫
૨૫	નિકાવા		૬૩૫૭૦ ૯૩૦૨૬
૨૬	લાલપુર		૬૩૫૭૦ ૯૩૦૨૭
૨૭	વડપાંચસરા	૦૨૮૯૫	૨૬૪૨૨૨
૨૮	કાનાલુસ		૬૩૫૭૦ ૯૩૦૨૯
૨૯	મોડપર		૬૩૫૭૦ ૯૩૦૪૦
૩૦	જામ ખંભાલીયા		૬૩૫૭૦ ૯૩૦૪૨
૩૧	ભાડથર		૬૩૫૭૦ ૯૩૦૩૧
૩૨	સલાયા	૦૨૮૩૩	૨૮૫૫૧૪
૩૩	જામ કલ્યાણપુર		૬૩૫૭૦ ૯૩૦૩૩
૩૪	ભાટીયા		૬૩૫૭૦ ૯૩૦૩૪
૩૫	ગઢકા		૬૩૫૭૦ ૯૩૦૩૬
૩૬	ચુર		૬૩૫૭૦ ૯૩૦૩૮
૩૭	રાવલ		૬૩૫૭૦ ૯૩૦૩૭
૩૮	લાંબા		૬૩૫૭૦ ૯૩૦૩૫
૩૯	ઘ્રારકા	૦૨૮૯૨	૨૩૪૦૧૧

બેંકના વિભાગીય ટેલીફોન નંબરની યાદી

ક્રમ	વિભાગનું નામ	ફોન નંબર
૧	બોર્ડ રૂમ	(૦૨૮૮) ૨૫૭૩૭૦૦
૨	જનરલ મેનેજર	(૦૨૮૮) ૨૫૭૩૭૦૧
૩	એડમી. વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૦૨
૪	એડમી. વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૦૩
૫	લોન વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૦૪
૬	એકા. ડી. વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૦૫
૭	એકા. આર. વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૦૬
૮	એકા. આર. વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૦૭
૯	એકા. આર. વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૦૮
૧૦	આંકડા વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૦૯
૧૧	આંકડા વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૧૦
૧૨	ડેવલપમેન્ટ વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૧૧
૧૩	ડેવલપમેન્ટ વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૧૨

ક્રમ	વિભાગનું નામ	ફોન નંબર
૧૪	ઇન્સ્ટ્રુક્શન વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૧૩
૧૫	રીકવરી	(૦૨૮૮) ૨૫૭૩૭૧૪
૧૬	રીકવરી	(૦૨૮૮) ૨૫૭૩૭૧૫
૧૭	ઓડીટ વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૧૬
૧૮	કોમ્પ્યુટર વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૧૭
૧૯	કોમ્પ્યુટર વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૧૮
૨૦	કોમ્પ્યુટર વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૧૯
૨૧	આસી. ઇન્સ. વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૨૦
૨૨	સ્ટેશનરી વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૨૧
૨૩	ક્લીયરિંગ વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૨૨
૨૪	ડીસ્પેચ વિભાગ	(૦૨૮૮) ૨૫૭૩૭૨૩
૨૫	સિક્યોરીટી	(૦૨૮૮) ૨૫૭૩૭૨૪
૨૬	એકાઉન્ટ ડી.	(૦૨૮૮) ૨૫૭૩૭૨૮

ફેક્સ નંબર: (૦૨૮૮) ૨૫૫૪૫૬૭

E-mail : jam_jdcb@yahoo.com / jdcb.jam@gmail.com